

હથેળીને ચહેરાનો સ્પર્શ - માત્ર,
 કુ
 આધાર ચહેરાને હથેળીનો -
 જવવા માટે
 ધબકવા માટે
 શાસ લેવા માટે -
 ની -
 એક જરૂરિયાત - અનિવાર્ય
 કુ
 સ્પર્શથી જાગતા
 સંવેદનો - આવેગો
 અને
 બસ
 એજ, એટલું - એમ જ.....
 બંધ ચપોચપ હોઠ પર
 સેકડો સવાલો સળવળે
 ને,
 આંખમાં અપેક્ષાના
 અંગાર પર પોપચાંની રાખ વળે -
 ટેરવાંઓના ઉઘાડ પછી,
 મેઘધતુષ આળસ મરડીને
 રૂંવે રૂંવે જાગો
 ને,
 ઝંખનાઓ હાથ પસારી માગો -
 હિસાબ,
 સ્પર્શની કાણોનો,

પળોનો - મિનિટોનો - કલાકોનો -
 દિવસોનો ને વર્ષોનો....
 કેમ ક્યારેય
 અગ્રધારું સુખ
 શબ્દોના વાદા પહેરીને
 નથી આવી જતું -
 એક કણ જવવાનું
 કારણ બની શકે
 એવું નથી સમજાઉ ?
 અચાનક...
 પૂછે છે -
 અપેક્ષા -
 ને,
 બરાબર
 એ જ
 વખતે
 એકબીજાને અડોઅડ
 બેઠેલી બે પાંપકાંની
 વર્ષ્યેથી
 અચાનક
 એક નાનકડી ફરિયાદ
 ગરમ - ખારી
 ભિનાશ
 બનીને
 કોણ જાણો ક્યારે સરકી પડે છે !
 આસુના ટીપાની સિલ્લકનો સિક્કો
 બંધ મુહીમાં લઈને
 ફરજો જ્યારે
 ઘડિયાળના ડંકા વગાડે
 ત્યારે
 ચહેરો હજીયે હથેળીનો સ્પર્શ
 ઝંખે છે -
 પણ.....

સાવ અચાનક,
જીર્ણ.... જીર્ણ....
બટકીને કંઈ તૂટે
રસ્તો ચાલે આગળ આગળ
વાતો જ્યારે ખૂટે

જે હતું તે -
ખોડા જે તું ?
પાણીના પરપોતા જે તું ?
મુહીમાંની રેતી જે તું ?
સર... સર... સર.. સર. સરકે !

નાની નાની
સાત કાળોના સરવાળો
ને,
નાના નાના સાત સ્પર્શના સુખના ગુણાકાર
શું ફકત શૂન્યમાં ?
સાવ અચાનક
શા માટે
આમ બટકીને કંઈ તૂટે ?

એક સંબંધ
જિંદગી આખી
વાત વાત ખૂટે !

અણાણા અણાણા થાય મને
ને મીઠું મીઠું ધેન ચડે,
સાવ અમસ્તો - આમ અચાનક
ઓચિંતો તું મને અડે.

સડપ દઈને જાગ્યો છે તું -
પરીકથાનો રાજકુમાર,
વગડામાંથી જડચો મને તું
જેમ નાગણને બીન જડે.

હું જ વગાડું ને હું ડોલું
ત્રીસ વરસનાં તાળાં ખોલું
કોરી સુક્કી આંખમાં મારી
અમલ-કસુંબલ રંગ ચઢે.

હું જ મારી કાળકોટડી
હું મારો એક દંડિયો મહેલ
મેં જ બનાવી, મારી માટે
કાળમીઠ પદ્ધરની જેલ.

તરફડતા શાસની
એક માત્ર દુષ્યાને નામ જો હું આપું,
તો તુ.

કુકડે કુકડે મારા જોડાતાં
સપનાંમાં, રંગોની છોળને
રંગોમાં લાલ રંગ તું.

અડધી મિંચેલી મારી
આંખોની આરપાર
જલમલતો તડકો
ને તડકાનો કુકડો - તો તું.

અમથું જરાક તું સામે જુવેને
પદ્ધી રગરગમાં દોડે
જે ધગધગો લાવા - તો તું.

અડધા - અધૂરા બધા
અસ્પદ લાગતા
શબ્દો ભૂટે ને પદ્ધી
સાંપડે જે અર્થતે જ, તું -

તારા વિનાના એક શહેરથી આજ અહીં હું, ખાલી આવી
ખાલીપાના હગલે-હગલા મારી સાથે લેતી આવી
લઈને આવી મારી સાથે,
ઓણ વખત આ કાળ ઉનાળો
સુકકા - કોરા ભંગ આકાશે
નડતડતો રેતાળ ઉનાળો.

આમ જુઓ તો અડકે નહીં તું
તું અડકે તો વાદળ ગાજે
શોષ પડે ને ખખરી બાજે
લાલધૂમ થઈ તપે ત્વયા
ને આંખો જૂકે, સઘળું લાજે
મને દાડે જાળ બનીને મારો આ શરમાળ ઉનાળો.

ઉર્દુ ઉર્દુ નાભિમાંથી ખાલીપાની હૂક ઉર્દુ
ને,
ફાટે છાતી
ચીરી નાખે અંગઅંગને
ઢંખે સઘળા સાપ સ્પર્શના
તરફડ તરફડ તરફડતી આ ખુલ્લી - ખાલી આંખોમાં
નિરાડ બનીને ફાટે શમણા -
તને ઝંખતી સાંજ પડે અહીં
રાત દૂબશે તારે ત્યાં હમણાં
ખાલી પડખું રાક્ષસ થાતું
બની જાય વૈતાળ ઉનાળો.

ધેરાયે, પણ વરસે નહીં તું
મારા માટે તરસે નહીં તું
સાવ અડોઅડ બેસીને પણ

તારી વાતો - મારી વાતો
ખાલી વાતો - ઠાલી વાતો
સાત રંગના સાળું પહેરી અમથી અમથી છાલી વાતો
સ્પર્શનો શૂન્યાવકાશ વિસ્તારો
અમાં ફૂલીફાલી વાતો

મને જોઈને સ્પર્શ સમૂળગો
તારે માટે ચાલે, વાતો !
અંગ અંગમાં શોષ પડયો
ત્યાં સાત ઘડાની હેલ લઈને
ધમકે બડે મુગજળ ભરવા
જોને, હાલી જાતી રાતો.
તરસી વાતો - તરસી વાતો
તરસ તરસતી મારી અંદર
તરસ્યો આ વાચાળ ઉનાળો
ધગધગ કરતું ધગે લોહી
ને સળગે હાડોહાડ ઉનાળો.

તારા સ્પર્શો રાખ ઉડાડી
તે અડકીને આગ લગાડી
સ્પર્શ કરીને શ્રાપ દીધો તે
જિંદગીભર જા, ગાળ ઉનાળો.

ધગધગતી તાવડી શી લીસી પથારી,
ને બળબળતો કોલસો આ કાયા
ઉના નિઃસાસા મારા ભાગમાં લખાયા
મુચ્યા, બાંધી મેં જ્યારથી આ માયા.

મનકું ને દેહ સાવ રખડે હરાયાં
ને છાતીમાં ઝૂમા ભરાયા
વાલપનો માર તેં એવો તો મારીયો
કે શાસ અને પ્રાણ બે હણાયા.

પરછયાની સોડમાં સૂતી હું ચેનથી
ને તારો કાં ચહેરો આ ઝળકે ?
રઘવાઈ થઈને હું પાસાંઓ બદલું
ને લુચ્યા, તું મીઠેલું મલકે.

આકાશી તારલા શો જુહ્યો અજવાસ તારો
ઘડીમાં તૂટે - ને ઘડી ચમકે
અમથાં જરાક કયાંક ખખડે કમાડ
તોયે જમણી આ આંખ મારી ફરકે.

એકલી-અટુલી તને ગોતવા હું રખણું
મને પાનીઢંક એરં વીટળાયા
ચાલ હવે તંખ માર, લોહીઝાણ - લીલોછમ
મારી ઝેર વિના તરફડતી કાયા.

મુછીમાં બંધ એક ભીનો સંબંધ
અને, ગલીઓમાં ગૂંજે છે - ગંધ
બળબળતા માંસની
ને
કડકડતી ખોપરીની ઉભરાતી કેસરી સુગંધ.

આંખોમાં રંગ હવે આતશબાળનો
અને, જીતવાની બાવન છે ચાલ
ભેટીને જીવવાના સોગન લીધા'તા
હવે ક્ષણે ક્ષણે ધરવાની ઢાલ.

શૂન્ય અને ચોકડીની ફેલાતી જાળ
અને, ક્ષણે ક્ષણ સળગો કાળજાળ
જીતવાને માટે જે ખેલાતી બાળ
એમાં શૂન્યોની છે હારમાળ.

સૌથી પહેલો પશ્ચર મારવાનો અધિકાર
મેં
તને આયો જ છે.
પડા,
તું રોજ મને એ અધિકારની યાદ અપાવે
અને
પશ્ચર ફેરે જ નહીં
તો, હું યે શું કરું?
તે 'પાપ' નથી કર્યું એમ માનીને
તારા હાથે
સંગસાર થવા હું તૈયાર છું
શર્ત ફક્ત એટલી જ
કુ
લોહી નીંળતો મારો છેલ્લો ચાસ
તારા ચૂંબનથી ઝંધી નાખજે.
મારા સુધી સમયસર ન પહોંચવા માટે
એટલી સજા તો ભોગવીશા ને?

વારતા રે વારતા
આઈ વગરના અંતાહિન, આ સંબંધોની વારતા -
હાથ પકડતા - હાથ જટકતા,
લડતાં - રમતાં
રમતાં - લડતાં
તડકાના ટુકડા સંઘરતા
ચારણીઓમાં પાણી લઈને
સપનાંઓની વેલો સીંયતા -
ગામના છેડે, વગડાઓમાં - ભટક ભટકતાં -
જડી આવેલા - મળી આવેલા સંબંધોની વારતા -
આંખ મળ્યાના હાથ અડયાના
ફળતી સાંજે બંધ હોઢમાં ઢગલો વાતો - ના કીધાના
દૂટાદૂટાચાયા ચાર પ્રસંગો
સરક સરકતી રેતીની જેમ મુહીઓમાં ભરી ભરીને
હકીકતોથી ડરી ડરીને
ખુલ્લી આંખો બંધ કરીને
દિવસ રાતભર જીવતા - મરતા - તરફડ તરફડ તરફડ
કરતા
સાચાં જુહાં બહાનાં કાઢી
એકબીજાને કદી ન મળવા વારે વારે કરગરતા
કદી શાબું ન બનનારા આ
દૂટા દૂટા અક્ષર જેવા સંબંધોની વારતા -

લંબાવું હાથ, તોય અડકી શકાય નહીં
ભડભડતી આગ - તોય સળગી જવાય નહીં
તારો ને મારો આ કેવો સંબંધ
જેમાં સામસામે બેસીને સામે જોવાય નહીં.

આંખોમાં ઉછળતા ખારાં પાણીનો હવે ઘળઘળતો -
ઘસમતો ધોથ
તારીછાતી પર મારી અટકેલી નજરોમાં નકરા આધારની
શોધ

અડધી રાતે મારી આંખો ઝૂલે
ને, ઝૂલે સ્વપ્રાંસો દીઢાની ભાષા
ભૂરી, ઉફણતી ને ધગધગતી રાતમાં

તુંય હોય જાગતો, એ આશા !
હોય તું - તોય તારા હોવાની સાબિતી
માંયા કરે મારી જત.
પડખામાં હોઉં ત્યારે ઊગે છે રાત
ને તું જાય ત્યારે આથમે પ્રભાત.

સગળની જાતને, ભડકે બાળીને
મારે કરવું અજવાણું તારા ઓરડે
સંબંધો બાંધવા કંઈ સહેલા નથી,
વડ વીટચા વીટાય નહીં દોરડે.

એકાંત મારી આંખમાં, ને ખાલીપો કાંખમાં
તોય તારા હોવાનો ભાસ
પડખામાં તારા - કોઈ નિરાંતે ઉંઘતું
મારી મુહીમાં મારો નિઃશાસ.

મરતા - જીવતા

ઉદતા - પડતા

દરેક હથોડા પાસે જાણે બચવા માટે કરગરતા
સંબંધોની વારતા.

વારતા રે વારતા

ભાભા ઠોર ચારતા

એક હતો છોકરો

ન જાણે કોઈ એનું નામ-

ન ગામ કોઈ -

ન ડામ...

દૂરદૂરથી આવતો -

એક ગુલાબનું ફૂલ આપી

છોકરીને સમજવતો

ને,

છોકરી કાયમ સમજ જ જતી

કુ

સમજવાનો પ્રયત્ન તો કરતી, કમ સે કમ.

એક દિવસ એ રિસાણી

સમજણ ના બોજે બિંસાળી

શાસે શાસે બોજ લઈને

દોષનો ટોપલો રોજ લઈને

આંસુઓનો હોજ લઈને

દોડી આગળ....

આગળ.... આગળ ને આગળ.

પાછળ બધું હેમખેમ

જેમ હતું અનું અનું

તૂટી પડચો સઘળો વહેમ.

છોકરી ગુલાબનું શોધે ફૂલ

સપનાંઓના ડબા ગૂલ

હાથ - જોડી,

ધૂંટણ તાણી માગ્યા કરે એ રહેમ... રહેમ..

પણ, છોકરો જેનું નામ-

ન જાણે કોઈ એનું કામ -

ન ડામ કોઈ, ન ગામ...

વાપરી જાણે બધા ઘાંદાં

દંડ-ભેં, સામને ડામ.

ઉઠે હથોડા - પડે હથોડા

વાગે ચાખુક ઉછળે ઘોડા

હાથી - ભંટ - દીવાનને રાજ....

અંદરોઅંદર મારતા.

જાને બિછાવેલી બાળ - જાત સામે હારતા.

એક બીજાની સામે લડતી સોગઠીઓને વારતા -

ને તોય -

ને તોય.....

મરતા -

મરતા - જીવતા

ઉદતા-પડતા

દરેક હથોડા સાથે જાણે બચવા માટે કરગરતા

સંબંધોની વારતા -

ભીતર કશુંક ભીતું ભીતું
 જળજળ જળજળ -
 અકળ, અચાનક, અમથું અમથું....
 બળબળ બળબળ
 તારું હોવું
 એ જ હવે તો મારું હોવું -
 આંખોથી આંખો સુધી
 એક સાંજ બળે છે
 ભડકે બળબળ -

રાત દિવસની
 ઝંખનાઓનું ખૂલ્ખોખાંચરે
 ટળવળ ટળવળ

આંખોમાં એક સ્વપ્ન
 સજળ છે
 સળવળ સળવળ
 આંખોથી આંખો સુધીના
 સ્પર્શોમાંથી
 ઝરી પડે અંગારા બધા
 ભડકે બળબળ
 લાલ ગુલાબી
 નીલા પીળા
 ધુમમસ ધેરા
 અધ ખુલ્લી આંખોના રસ્તા
 તારા સુધી લઈ આવે ને
 પળમાં બધું
 નિષ્ફળ નિષ્ફળ
 ભીતર કશુંક કોરું કોરું
 અકળ, અચાનક અમથું... અમથું...
 નિજળ - નિજળ.....

સાવ અચાનક

દળતી સાંજે

લાંબા લાંબા ભરયક રસ્તે,

બહાર નીકળતાં ધરમાંથી - કે,

હરીફરીને પાછાં ફરતાં

ખાલી લાગે, ઊરે ઊરે.....

સુકું-સુકું બરડ-બરડ કંઈ, 'ખાક' દઈને દૂરે
ત્યારે,

એ જ ક્ષણે તું માની લેજે-

અહીં કોઈ આથમતી સાંજે

મિત્રો સાથે વાતચીતમાં (!)

મે જ તને યાદ કર્યો છે.

ઉંચા ઉંચા પડછાયાથી ઢંકાયેલા લાંબા રસ્તા
ગેસ-ફૂકર, શોપિંગ, નાસ્તો-જમવાનું ને ફોનની રીંગો
એકલવાયી - ચૂપચાપ કોઈ ઠંડી ઠંડી સૂની સાંજે -
સત્યજીતનો હસતો ચહેરો.... એકીટસે જોતાં જોતાં
'ફટાક' કરતી ઊભી થઈને - ધર છોડીને ચાલી જઈશ હું

-
સાવ અમસ્તી વાતો કરવા કયાંક જઈને ઊભી રહી જઈશ

ખાલી હિંચકો,

મારી સામે આંખ મિંચકારી

મર્માણું - હુંફાળું હસતો 'આવ' કરીને ઊભો રહે

ખભા ઉંઘાળી - હોઠ લાંબાવી

'સોરી' કહીને આગળ વધતાં

માની લઉં હું - કે, તું પણ મને યાદ કરે છે ?

અહીં ચાલશે બધું જ એવું -

ખાસ ખણું 'ના' કહેવા જેવું !!

એ જ,

શબ્દોની જીમાઓડી

લાગણીઓની ટીંગાટોળી

આગળ - પાછળ - ઉપર - નીચે - બહાર - ધરમાં

સાવ અમસ્તી દોડાદોડી !

ખાલીખામ એકલવાની એ તૂટીફૂટી કોઈક પળે

કૂસું જ્યારે ગળા સુધી આવીને અટકે -

બસ,

ત્યાં જ બરાબર -

એકી ઝટકે,

ઘસી ઘસીને ભૂંસીશ હું -

એ બધી વાતો - બધી રાતો - ભૂંસ્યા કરીશ કલાકો સુધી...

કદીક થાડી ઊંઘી જઈશ હું -

કદીક ઊગ કાઢીશ રાતો -

ખૂટશે બસ 'તું' - તારી વાતો !

ખાસ કણું બીજું નહીં ખૂટે.....

આ રોજ - રોજની,

ભાગડોડની - સડસડાટ એ રફતારોમાં,

ખૂટશે બસ તું - તારી વાતો !

કોઝીનો એક બીજો કપ ને લાંબી લાંબી જાગતી રાતો.

બિયરનો એકબીજો મગ - ને ટચાક ટૂંકી પડતી રાતો.

આટલું બધું

સાવ અચાનક

આવી રીતે કેમ થાય છે ?

ખબર નથી, કોઈ કેમ મળે છે ?

ખબર નથી, કોઈ કેમ જાય છે !

ખબર નથી કોઈ કેમ મળે છે - ખબર નથી, કોઈ કેમ જાય
છે.

આમ તો ધાર્યા કર્યું અજાધાર્યું તારું આવવું
શર્ત ફક્ત એટલી, તું ધારે ત્યારે જઈ શકે

તું અને હું બંધ - ઉચ્છવાસે સળગતી રાતમાં
સૂરજ ન જુવે આ તરફ શું એવું ન થઈ શકે ?

આંખ મારી બંધ, તારી હોઠના સંસ્પર્શથી
ટેરવાંની તે જ ધારો રૂંવે રૂંવે જોઈ શકે

આપણી હા-નાની વર્ષે જંજાવાતી વાયરો
એકવાર પામ્યા પદ્ધી કોઈ પણ તને કેમ ખોઈ શકે ?

બંધ મુહ્ખીમાં તને લઈ આવવાની જ્ઞ હતી
જેણો મને ત્યાં રાખી લીધી એ બીજું કોણ હોઈ શકે ?

આટલાં બધાં હગલોક સપનાં ને ટચ્કડી વારતા
થાસ જેટલું સત્ય છે જે, તે રમત ન હોઈ શકે

લોહીનો સંબંધ
એક જન્મનું ઝણ માત્ર બની ગયો છે
એક વજનદાર ઉપકાર
જેને વેંફારવાની ટેવનાં પલાંખા રોજ પઢી આઉં છું
પોપટની જેમ.

સુકાઈ ગયેલા
તરડાયેલા
ઠંડાગાર સંબંધો
અવાવરૂ ઘર જેવા
ઠેર ઠેર સ્મૃતિનાં જાળાં...
ગાઈ, ચામાચિડીયાના ફફડાટ કયારેક.

તારીખ - વાર - સમયની નોંધ સાથે
ગણોલા - ગણાવેલા અહેસાનો
અને, હું ‘ધાવણા-હલાલ’ માત્ર.
પિતુંદોષથી પિડાતી કુંડળીના ચકો
સૂર્ય - બુધ - શનિ - ચંદ્ર
ને મન થુકની શોધમાં - સતત.

બે હોઠ વચ્ચેથી નીકળતાં
તમતમતાં તીર
નાગી તલવારો સાથે
સતત ઝૂઝુમતા - મરણિયા થતાં - ‘અમે’
ઘાલ ધરતી - વિંધાતી - નિશાન સાધી વિંધી નાખ
હું

શક્તા - વિશ્વાસ - સન્માનને
નેવે મૂકીને.

રોજ એક પગથિયું નીચે ઉત્તરતા -
અમારા તરફડતા, ડચકાં ખાતા સંબંધો
કશું જ આપજું નહીં, હવે
‘હું’ અને ‘તમે’માં પડવાય છે
ખાતર-પાણીની ખામી.

પ્રથમ વર્ષગાંઠની મિણાબતી
ખડખડાટ હાસ્યો
અને
લાળ ભરેલા સ્વિમતમાં દૂબેલા
કૃટલાક ભર્જ પ્રસંગો હજુયે છે આલખમમાં
રીખાહિરેલ કંદૈબીહછીજ
પોસ્ટકાર્ડ સાઈઝની નાનકડી ફેમમાં
ગણોય જણાં હજુયે સાથે મુસ્કુરાઈ રહ્યાં છે.

અને,
છ બેડરૂમના ફ્લેટમાં
ગણ માન નથી સમાઈ શકતાં.

દરેક વાક્ય આણો જીતવા માટેની રમત છે કે યુષ્ટ છે
ઇદ્વીઓસેહખેજ કહેણે જીવણી સુકર્જ
ન્હી નથી
ઉક્રીછે, આ.

જન્મનો સંબંધ
એક લોહીનું ઝણ માત્ર બની રહ્યો છે હવે
લોહી તરસ્યું ઝણ
મારા પોતાના લોહીની તરસ
અને
ઝણ - જન્મનું.

હવે સળગે છે સંબંધો ચારે તરફ
આવે આતશબાળનો ઉઠાવ
મૃત્યુ પામ્યો છે - આ આપણો સંબંધ
હવે ટોપી કાઢીને માથું ઝૂકાવ.

શમણાંના રંગો હવે ઊરી ગયા ને,
ખરે પોપડાઓ ભેજભરી ભીતથી -
પાયો જ કાચો છે આપણી ઈમારતના,
છો ને ચડી સોનાની ઈંટથી.

બેમાંથી એક હવે ચાલ્યું જશે
ને પદ્ધી ખાલી થવાનો આ માળો
આવનારી કાણને તો તેંજ ભાખી છે
હવે કેમ કરી 'હોની'ને ટાળો ?

સંબંધો તૂટશે ને તીરો વધૂટશે
પદ્ધી બધુંયે આશે રસાતાળ
તોય બધા રસ્તા કંઈ ભોમાં નહીં ઉતરે
ને ભળી નહીં જાય આભ-પાતાળ.

પાંપજા પડો છોડીશ, પલળીને ચૂવાનું
પાણી સુકાઈ જશે કપાળના ફૂવાનું
ને, તોય રોજેરોજ થશે સાંજને સવાર
નાનકડો કાંઠો બસ છાતીમાં ક્યાંય સુધી ખૂંચતો રહેશે
લગાર -

હથેળીની રેખાઓ એમની એમ રહેશે
બાજુની પથારી જેમની તેમ રહેશે
રાતોની રાતો બસ જાગીને વિતશે
ને હારેલી બાળમાં બેય જણ જીતશે.

એક દૂબેલા સૂરજથી તે -
 બીજા દૂબેલા સૂરજ સુધી
 લંબાયેલી સાતે કણ
 ને, સાત સુગંધો
 સાત રંગને સાથે લઈને
 બંધાયેલા મેઘધનુષી સંબંધોની
 આખી વસ્તી
 ભટક ભટકતી
 રખડ-રઝળતી
 હજ
 કેમ
 બેચેન ફરે છે ?
 કેમ નથી સમજાતું અને
 જીવવા માટે તરફડતા જે -
 સૌથી પહેલાં એ જ મરે છે
 સરી જાય છે - સરક સરકતી
 સાતે કણ
 ને, સમય જતાં
 એ સાત રંગ પણ ફીક્કા લાગે
 સાત સુગંધોના એ દરિયા
 અફકાર રણ શા સુક્કા લાગે
 સંબંધો પણ સર સર સરકે
 મુહીમાં જેમ રેત સરે છે.
 કહેવાની જે વાત હતી તે
 કહ્યા વિના પણ
 વાતો ખૂટે
 રાતો ખૂટે
 સંબંધોના ભાથામાંથી સમસમ કરતાં તીર લીલાઇમ જે સ્પર્શ
 વણૂટે
 ચૂર ચૂર થઈ હૂટે આપના
 પુલો બધા તડતડ ટૂટે
 તડ તડ ટૂટે
 મહેલ - મિનારા

સ્વપ્રાંઓનાં
 ચણ્યા કીધા જે
 કંઈ વગર વિચાયે - જાણ્યે - સમજ્યે
 ખરી પડે
 એ બધા બૂરજ
 જે બાંધી બેઠા લાગણીઓના અણાઘડ
 કાઉયા
 ઘટનાઓના કાટમાળને
 અવશ ઉલેચી
 પડી - આખડી
 અથડાતા - ફૂટાતાં જ્યાં ત્યાં
 શબ્દો આવી જીભા રહે
 ને
 નજર મિલાવી પૂછી તમને -
 કેમ કીધું'તું 'ભેળાં રહીશું ?'
 કેમ કીધું'તું 'હળશું - મળશું ?'
 કેમ તમે એમ નો'તું કીધું
 'ક્યારેક છળશું'
 'હોઠ સુધી પણ આવી જઈને
 ક્યારેક ક્યારેક પાછા વળશું'
 'સંબંધોની સીધેસીધી વહી આવતી
 શાંત નદીમાં સાપ બનીને - (શાપ બનીને)
 ડંખ મારશું - સળવળ કરશું'
 કેમ અચાનક ભડકે બળતા
 સંબંધો પણ ઠરતા લાગે ?
 એક અમસ્તી સાદી કણમાં
 ડાળેડાળે ફૂટી નીકળ્યા
 સંબંધોના ભાથામાંથી સમસમ કરતાં તીર લીલાઇમ જે સ્પર્શ
 હવે એ ખરતા લાગે.

આગું'તું, જે આળસ મરડી
 લાંબી ઠંડી જીંધ પછી
 એ નામ અચાનક ઊંઘરેઢું થઈ સુવાગેલ
 ટ્યુ ટ્યુ આંખો ચૂવા લાગે.....

આંખ હવે આંખોને તાગે
 હાથ પસારી પાછું માગે
 લાવ, તનો જે દીધું તે એ -
 લાવ, બધું તે કીધું'તું એ -
 લઈ જા બધું લીધું તે એ -
 ભલે, બધુંયે ભૂલી જઈશું
 જ્યાં હતાં ત્યાં પહોંચી જઈને
 જેમ હતાં એમ સુખથી રહીશું
 ખાંધું-પીધું - રાજ કીધુંની
 સાવ હડોહડ જુહી વાતો
 માની લે કે કહેતાં રહીશું
 ને, તોય હજ એ સંબંધોની
 આખેઆખી
 સુની વસ્તી
 ભૂખી - તરસી
 ભટક - ભટકતી
 ક્યાં સુધી બેચેન બનીને ફરતી
 રહેશે
 ક્યાં સુધી એ સુખની વાખ્યા
 તારી સાથે ગાળેલી બસ સાત
 કણોમાં બંધાઈને
 કરતી રહેશે - કરતી રહેશે....
 હળતા સૂરજને ઓછાયે
 હાણ ઉપર
 અહીં જીભા રહીને
 આપ્યાં - લીધાં જે ચુંબન
 તે કેમ કરીને ભૂલી જઈશું ?
 સભર ભરેલા ભીના સ્પર્શો
 આંખોમાં આંખો નાખીને
 નહોતી કીધી
 જે જે વાતો
 એ બધી પણ મારી પાસે
 વણાખોટી અકબંધ પડી છે
 કેમ કરીને પાછી આપું - બધી
 રાતો,
 તારા વિના ખેંચી કાઢી
 ખુલ્લી આંખે

બે શરીર
ને, એક પથારી
અધી તારી અધી મારી
બધું વહેંચી લીધા પદી -
જોઈએ તેટલી છટકબારી
હોઠ ઉપરની સુકકા છારી
પાંપણ ખારી
તારી કે મારી ?

સૂરજ દૂબે - સૂરજ ઉગે
આંખો જાગે - આંખો ઉંઘે
વાતોના ફૂલોને સ્ફૂર્ધે

ચાર દિશાથી આવે રસ્તા
મનના ઘરને બત્તીસ બારી
રોજ સવારે રાત પડે
ને, રાતે લાગે સવાર સારી

અડધા-પડધા શબ્દો સાથે
અડધી-પડધી વાતો વાગે
વાતો બધી સારી-સારી

ઠંડી ઠંડી રાતો જાગે
હાથ અડેને ચાબુક લાગે

આંખો હવે આંખોને વાગે
બધાં સપનાં પાછાં માગે -
બે શરીરને એક પથારી
આંખો કોરી - હૈયું ભારી
એક શરીરને બે પથારી
બેઉ મારી - બેઉ તારી

‘સત્ય’ના સંદર્ભો જુદા થઈ ગયા છે
જે કાફર હતા તે ખુદા થઈ ગયા છે.

હમસફર જે રહ્યા છે, તે રહ્યા છે રકીબો
જે મિત્રો હતા તે બધા કયાં ગયા છે ?

‘હું અડકું તે સોચું’ એ માગી લઈને
જુદાઈના ગમ કયાં મેં ઓછા સહ્યા છે.

લાગણીના સંદર્ભે શબ્દો હંમેશા -
મને ઓછાં પડ્યા છે, ને પડતા રહ્યા છે.

તડકો - પડછાયાને બળબળતી સ્મૃતિઓના
બધાએ પ્રસંગો મેં હજુ કયાં કહ્યા છે ?

એકવાર - બસ એકવાર

તું

મારી અંદર ફેલાતો જા,
આંખજું કાજળા - હોઠની રંગત
સાથે લઈને રેલાતો જા,
સુકકા-સુકકા તત્તી ગયેલા
અંગ ઉપર

તું

છાલક થઈને
'છપાફુ' દઈને વાગ જોરથી
રોમ રોમ પર ફીડાફીડા થઈ વિખરાતો જા.
બંને કંઢા તોડી નાખી
બસ, ધસમસતો વહી આવ તું
બુંદ બુંદ થઈ આખેચાખો
મારી અંદર ઠલવાતો જા,
અંગ અંગ ને ભીસે દઈને
ચૂર - ચૂર કર, લોહીના લયમાં ભેળવી દે તું
રંગના કુંડા ભરીભરીને કમખા ઉપર ચિતરાતો જા
ભનીસ કોઠે દીવા થઈને
મારી અંદર જળહળતો જા.

તમને ક્યારેક થતું હશે નહીં?...હું તે કાંઈ માણસ છું?
મનેય થાય હોં! જીઝે જીઝે...હું યે ભાઈ, માણસ છું.

દૂધ-દવા-કરિયાળું-ધોબી-સ્કૂલ-વીજળીને છાપાંઓના
લાંબા લચ બિલોની નીચે દટાયેલો માણસ છું.

જિંદગીની ખરલમાં હું દરેક લસરકે કડવો થયેલો
દરેક ઘટનાને લીધે આણે વધુ ઘૂંટાયેલો માણસ છું.

સાતને વીસની વિરાર લોકલ,
ફાઉન્ટનના વડાપાંવમાં લપેટાયેલા લંચ ટાઈમને લુસલુસ
ખાતો
રવિવારને છોડીને હું રોજ રટાયેલો માણસ છું.

શ્રીય કેન્દ્રીના શ્રો-વિન્ડોઝની મેની કિવિનથી શરૂ- કરીને
બેરીના કકળાટ સુધી હું લંબાયેલો માણસ છું.

ચાર વાગ્યાના નળની સાથે ‘ધબ’ કરી સફાળી ઉઠતી
બેરીના પડખામાં
રોજ ઠેલાતો - હડસેલાતો તરફોડાયેલો માણસ છું.

ક્યારેક બેરીનો ગજરો ને ક્યારેક ચોકલેટ નાનકા માટે
કવિઓ અને કવિતાઓ માટે સાવ ભૂલાયેલો માણસ છું.

આમ તો આણો, બધા કહે છે -
લાગળીઓની બાબતમાં હું સાવ કટાયેલો માણસ છું.

કૂદકે - ભૂસકે જીંચા વધતા સાત ટાપુના શહેરને જોતો
ચાલીની પરસાળમાં બેઠો ડધાયેલો માણસ છું.

માત્ર પથારીના સંબંધ આપણા,
પથારી જેવા જ.
જગ્યા ન હોય તો વીંટો વાળીને ઊભા કરી દીધા
અને જરૂરિયાત પ્રમાણે પાથરી દીધા - જેમ ફાવે તેમ !
જરૂર ન હોય ત્યારે
કોઈને ખબર ન પડે એમ પલંગના બોક્સમાં બંધ કરી
દીધા
ડોઈંગ રૂમમાં 'એથનિક ટચ' માટે લાવીને મૂક્યા,
ત્યારે આભલા-ભરતની ચાદર બિંધાવી દીધી !
એક ચાદર મેલી થાય તો કાઢીને ફેંકી દીધી
નવા રંગની ચાદર પાથરી દીધી - જ્યારે ફાવ્યું ત્યારે !

થાક્યા-પાક્યા લંબાવ્યું -
ન.....
નહીં તો દિવસો સુધી હુંક્યા ય નહીં - એ તરફા

યાદ કરવું હોય તો
 બધું જ યાદ આવે
 અને
 યાદ આવે પછી કશ્યું જ યાદ 'કરવું' ન પડ.
 પોપચાં ખુલ્લાં રહી જાય
 પડખાં બદલાયા કરે
 ગરમ-ખારું પાણી આંખોમાંથી
 સુકકા ગળાને ચચરાવતું
 ટપકયાં કરે - રાતમર
 ને, ઓશિકું પલળી જાય - તરબતર
 સવારે ઊઠો ત્યારે
 'ગાઉન'ની જેમ રેશમિયું સ્મેટ પણ
 વગર ભૂલ્યે ચિપકાવી લો.
 બીજું બધું ભૂલવાનો બમ ટકાવી રાખીને
 રૂટિનની શરૂઆત થાય.....
 આમાં..
 પણ માત્ર એક દિવસ
 જો તમે રજા પાડો તો,
 જાણો માન્યામાં ન આવે!
 મહેરાંઓ વિનાનો તમારો ચહેરો કોઈને રૂપાળો ન લાગે
 દૂઠીને કોઈનો ખભો માગે
 ત્યારે જ તમને સમજાય
 'આધાર' શબ્દ તો તમે ચેકી નાખ્યો હતો
 તમારા પોતાના શબ્દકોષમાંથી - હિંમતપૂર્વક.
 'સંબંધોની જરૂર વળી તમને ક્યાંથી પડી ?!'
 સવાલો તમને આરપાર છેદીને નીકળી જાય - છેદતા રહે
 અને એમાંથે,
 જ્યારે
 કોઈ સાવ 'સ્વજન'
 તમને પૂછો
 'યાદ આવે છે. ક્યારેક....?'
 તો ?!

તું મને મળ્યો.... સાવ પહેલી વાર
 એ કાણથી લઈને હજુ હમણાં,
 તું ગયો ત્યાં સુધી
 આપણા સંબંધોનો રંગ પળે પળે પલટાતો રહ્યો છે...
 ..ક્યારેક વહેલી સવારના ફૂલો જેવો
 સ્વર્ચદ્ધ, નિર્ભેણ, ધોયેલો ઝાકળભર્યો તાજો તાજો સુગંધી
 રંગ !!
 ક્યારેક મોરપિચ્છ જેવો
 ચમકદાર, રેશમિયો, અજબ નજીકતભર્યો
 વ્યવસ્થિત ગોઠવાયેલો
 અને છતાં, વગડામાંથી અચાનક જડી આવેલો રંગ !
તડકાની તીવ્રતાથી
 ચામડીને આરપાર વીંધીને દાડી-તરફડતી તરસના
 શોષથી
 સુકાતા ગળાને ચરચરાવી જાય એવો ધગધગતો રંગ !
 તો
 ક્યારેક જંજવા જેવો લાગતો સાવ,
 ધેરાયેલાં વાદળોની અંધકારભરી અકળામણવાળો
 ધોખમાર વરસાદનાં બુંદ બુંદને તરસી જતો
 આશા - અપેક્ષાથી ભરેલો ફરિયાદી રંગ !
 વળી,
 મુશળધાર વરસતો ક્યારેક,
 રોમ - રોમને ભીંજવીને તરબોળ કરી જતો
 ભીની ભીની દૃષ્ટિનો હરિયાળો રંગ !

...દીવાલ સાથે માથાં પછાડી પછાડીને
 હતાશ થઈ આવ છતાં
 કાંગરીયે ન ખરે - એવાં, ચસોચસ ભીડેલાં કમાડની
 એકલતાનો,
 અકળ મનની અટપટી ગલીઓનો કાળો ડિબાંગ રંગ !
 આંખ ખૂલે ત્યારે
 અજવાળાંથી અંજાયેલી આંખોમાં દૂધાયેલી
 ઉજાસની ઝંખના - છતાં,
 અચાનક આ... ટલા બધા અજવાળાંને ખમી ન શકતા
 આભાસી અસ્વીકારનો રંગ !
 .. અને ક્યારેક તો વળી
 મેઘધનુષ્ય જેવો આકષ્યક, નમણો
 અલૌકિક અને છતાં આભાસી -
 આસ્થેર હોવાની પૂરેપૂરી શક્યતાઓ સાથેનો ક્ષણજીવી
 રંગ !
 અને એ બધા જ રંગોના શંખુમેળાની વર્ચ્યે,
 શાંત - તેજસ્વી
 સ્વસ્થતાનો દૂધિયો રંગ !....
 .. ઉબડ-ખાબડ કાંટાળા રસ્તાઓની
 આપણી સફર દરમિયાન
 મારા હાથને પકડી રાખતો
 તારી સમજદારીનો, મજબૂતીનો
 સત્ય અને સાતત્યનો
 શુદ્ધતમ સફેદ રંગ !
 આપણા સંબંધના પલટાતા રંગો - બધા જ રંગો
 એમાં સમાઈ જાય છે... સમાઈ ગયા છે !
 મારા બધા જ સવાલોના જવાબો
 તારા સ્પર્શમાં - તારા સિમેતમાં - તારા સાનિધ્યમાં
 આપોઆપ પ્રગટે છે !
 હું ધીમે ધીમે સફેદ રંગના તારા વિશ્વાસથી ધોળાવા લાગી
 છું....
 મને થોડોક સમય આપજે - હજુ,
 મારાબધા જ રંગો સમેટવાનો,
 એક ચપટી સિંદુરની ભૂરકી છાંટીને
 મને લેળવી દેજે
 તારા થેત - શુદ્ધતાના
 સત્યના સામ્રાજ્યમાં !

માણસની યાદદાસત ગજબ ચીજ છે !
વખો સુધી દર્દના પોપડા જમતા જ જાય
ને તોય
નાની અમથી ઠેસ
બધું જ ઉખાડીને સાવ જૂના ઘામાંથી લોહી કાઢે.

એકાંતનું કારણ હોઈ જ કેવી રીતે શકે ?
ને, અસ્તિત્વના ટુકડાઓને કેવી રીતે વીણી શકાય ?
છતાં
આંખોના રણને આંસુથી સિંચવાનો પ્રયત્ન તો આપણે સૌ
કરીએ જ છીએ ને ?

જાતને છેતરવાની સાલી, મજા પડે છે, નહીં ?
અહૃતસિવથી માંડ માંડ ચોંટાડેલા નાજુક અસ્તિત્વ ઉપર
રંગરોગાન કરીને બીજાને તોડ્યાનો સંતોષ
કેવો અદ્ભુત - કેવો ગળયણો લાગે છે.

માણસની યાદદાસત પણ ગજબ છે
બીજાના ઘામાંથી પોપડા ઉખાડતી વખતે
પોતાના ઘા કેટલી આસાનીથી ભૂલી જાય છે !

મને લાગે છે
 હું ખરેખર 'સેડીસ્ટ' છું
 મારા પોતાના સ્વપ્રોને તરફડી - તરફડીને
 મરતાં જોવાની
 મને હવે મજા આવવા લાગ્યો છે.

મારી પોતાની લાગણીઓ
 જ્યારે છેલ્લાં ડચકાં લેવા લાગે
 ત્યારે, અજબ સંતોષની લાગણી ફેલાઈ આય છે
 તન-મનમાં !

વચન આપ્યા પ્રમાણો જો તું સમયસર આવે
 તો ખોટા પડ્યાંની - અણાગમાની લાગણી થાય છે.
 એકલા પડ્યાં રહેવામાં
 'નિંલેકેટર' અનુભવ કરવામાં
 એક છાની મજા પડે છે.

મારા જ ચણેલા મહેલાને
 લાત મારીને તોડ્યાં પદ્ધી
 કૂર અહૃદાસ્ય કરવામાં એક અદ્ભુત સુખ છે,
 એ તો હજુ હમણાં જ સમજાયું છે.
 કોઈ પ્રેમ દેખાડે, કૂણી દિશાઓ ફંફોસવાનો પ્રયાસ કરે
 તો,
 પોલી-બોઢી સહાનુભૂતિના રણકા ખખડ્યાં કરે છે.

પણ હા,
 કોઈ એકાદી કેસરી-એકાંત સાંજે
 મારી લાગણીઓ જાદ પકડી બેસો
 સંવેદનાઓ દૂસ્કે ચર્દે
 ત્યારે શું કરવું એ હજુ નથી સમજુ શકી.

એક ઉંબર પર જાટકા સાથે તોડીને જે ફેંકી દીધું તે
 એ તારે માટે બંધન હતું
 અને મારે માટે અવલંબન.
 ભૂલો હોય છે - થાય છે, સૌની,
 પ્રમાણભાન તો હોય ને, સજા આપતી વખતે ?!
 પહેલીવાર પોતાના પગ પર ચાલતાં શિખેલું બાળક
 કંદાય, પડી જાય.. પડી પણ જાય !
 એક કે એકથી વધુ વખત,
 તોય,
 પગ કાપીને ફેંકી શકાય ? માત્ર સજારૂપે ?
 પંખીને પાંજરાની સલામતીનો અહેસાસ થયા પછી
 મુક્તિની સજા ફટકારવાનો અધિકાર છે, કોઈને ?

માગણીઓ નકારી શકાય... અધિકારો અવગણી શકાય...
 પણ લાગણીઓને - સંવેદનાઓને
 આમ સાવ ઘંખેરીને સ્વસ્થતાપૂર્વક કેમ ચાલી જઈ શકે,
 કોઈ પણ ?

એક વ્યક્તિ પાસે એનો અર્થ - એનું અસ્તિત્વ
 એનું અવલંબન ઘૂંચવી લેવાની સજા.....
શું એટલો માંઠો કોઈ પણ ગુનો છે ખરો ?

આપણે બધાં જ બધા કરીએ છીએ
 ઝીણું ઝીણું
 અગરબત્તી જેવું નહીં
 સિગરેટ જેવું - લીલાં લાકડાંની ચિતા જેવું,
 આપણા ધૂમાડા
 કોઈએ 'ઓક્સેલ' કરેલા - પણ તુકસાન બીજાને કરે એવા
 'પેસિવ સ્મોકિંગ' કરાવતા, સતત,
 પેટ્રોલમાં કેરોસીન મેળવીને ચલાવાતી રિશામાંથી નીકળતા
 'સ્મોક' જેવા
 બધા મળીને 'ઓક્યા' કરીએ છીએ
 કાબ્ન ડાયોકસાઇડ, સતત !
 ઓકબીજાને તાકીને ઓક્સેલ કરીએ છીએ,
 અને
 ધર - ગલી - ગામ - શહેરમાં
 કાળા - ધોળા - કાબરચીતરા
 ધૂમ-ધૂમ ધૂમાડાના વાદળો,
 પાછાં વાતો 'સન-સેટ' ની કરીએ છીએ
 મરીન ઝ્રાઇવ પર બેસીને
 આપણે સૌ
 'કિલન અને ગ્રીન'ના પાટિયાં નીચે..... બરાબર.
 ચણાચોર ગરમના ખાલી પડીકાં, સિગરેટનાં હુંડા,
 ચોકલેટના રેપર અને કોલાકોલાના ટીન.
 'જરા આઉટિંગ - સાંજનું'
 વળી પાછા
 કારના ધૂમાડા.
 'અમે શું કરીએ ? પેટ્રોલ જ ખરાબ આવે છે !'
 રાત્રે 'જરસ્ટ ટેસ્ટ'
 કુ
 'શામિયાના'માં
 કોફીના ટેબલ પર
 સુડો વાતો સાથે
 પોલિટિક્સ, ફિલ્મ અને બ્રાન્ડ ઇક્વિટીની ચચાઈઓ સાથે,
 ફરી - ધૂમાડા
 'નાઈટ ઇઝ સ્ટીલ યંગ'ના ચવાઈ ગયેલા
 ચ્યુટિંગ ગમ જેવા
 ચીકડા શબ્દો સાથે
 વળી ઓકબીજા સામે ઓક્સેલ
 કોફીના ટેબલ કોઈના ધણી સામે
 ગુંચવાતી નજરના ગોટેગોટા
 બિઝનેસની વાતો સાથે બાટલીમાં ગુંગળાતા ધૂમાડાને

મારી અંદર - બાહર
 ઉપર - નીચે
 આગળ - પાછળ
 તું!
 શાસ ભરીને
 સુંધી જોઉં
 તો
 નત - ઉત્તત
 આ સતનની વર્ષે
 તું - માત્ર તું!
 ખર્ચાક દઈને
 નસ કાપીને
 ધક્કધક વહેતા લોહીને જોઉં તો
 લાલ રંગના
 ટીપે ટીપે
 વહેતો રહેતો તું!
 આંખ મીંચીને
 સહેજ અમથી અંધારા એકાંતને જાજું
 ત્યાં
 એક વિલસતું સ્વિમિંગ લઈને
 રંગરંગના વાદળ વર્ષે
 ઊભરાતો જાય તું!

આંખો ભીની
હૈયું ભીતું - આંસુ ભીનાં મારા
સૂરજ દૂબે - સાંજ પડે
હું સપનાં ગુંધું તારા.

મને ખબર છે - તને ખબર છે
સાવ જિંદગી નાની
પગલાં આપણાં જ્યાં પડે ત્યાં
ધાપ નથી રહેવાની.

રેતી કોરી - રસ્તા કોરા - કોરા સાવ કિનારા,
ખાલી મુહી - ખાલી આંખો - ખાલી વરસો મારા

રોજ સવારે રોજ સાંજના
સપનાઓનાં જાળાં
આજે જ્યાં મહેફુલો છે ત્યાં
કાલે પડશે તાળાં.

તારી મારી હથેળીઓની
ગુંચવાતી - ગુંથાતી રેખા
માગે છે એક એવી પળ
જ્યાં બે નામને જોડી દેખી બની જાય એક માળા.....
મણકે મણકે બાંધે -
નેડુકડે ડુકડે સાંધે
એવી પળના રંગે -
એકબીજાનો સંગ
આવે બધાં સુખો સુંવાળા.....

મારા જીવતાં જ મારું શાક કચુંતે
ને છતાં
અતૃપ્તિ ખુલાસા માગતી ભરકે
જરીરિત સંબંધોના ખંડિયેરોમાં.. આજ લગી.

તારા હોઠથી
 મારી ખુલ્લી હથેળીઓ સુધી લંબાયેલી
 મૌનની વણાઉકેલી ગુંચવણોવાળી અંધારી ગલી
 લોલકની જેમ
 તારી 'હા' અને 'ના'ની વચ્ચે
 અસમંજસમાં અટવાયેલું મારું અસ્તિત્વ
 તારા રૂપરૂપમાં પિગળી જતી
 ગરમ ગરમ મખમલી રાત
 અને
 ખાલી પથારી સાથે ઉગતો
 સવારનો ઠંડોગાર સૂરજ
 તું હોય -
 આસપાસમાં,
 તારી છાતી પર માથું ટેકવી શકું ત્યાં સુધી જ
 માની ન શકાય છતાં
 ચગળવી ગમે એવી
 સ્વપ્રીલ - વજનદાર - વાહીયાત (!) વાતો
 પછી
 એકાંતની સૂની કષણોમાં
 ફરી લોલકની ટીક - ટીક
 અવિશ્વાસ - વિશ્વાસ
 અસ્વીકાર-સ્વીકાર
 આભાસ-સત્ય
 ના-હા
 કયાંક કેન્દ્રબિંદુ શોધીને મારા અસ્તિત્વને સ્થિર કરવા
 મથામણ કરતી હું -
 કયારેક જવાબ આપી જતું મારું ધેર,
 અને ફરી માથું લોંઘકતો તારો સવાલ,
 'હવે હું આઉં?'

અચાનક સંબંધ છટક્યો
 પડ્યો...
 ને તૂટી ગયો
 સમયની સાવરકી ફેરવી ફેરવીને થાક્યા છતાં
 હજ્યે - કરચોથી મારાં તળીયાં લોહીલુહાણ કેમ થઈ જાય
 છે ?
 દૂટેલા મંગળસૂત્રના દાઢા
 હજ્યે મળી આવે છે અવારનવાર
 ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ હજ્યે જતી નથી
 લોહીના ધાબાં જેવાં લાગે છે ગુલાબની કચડાયેલી
 પાંડડિઓના ડાધ
 ચોળીને ચોળીને નાહ્યા છતાં
 સતત વીઠળાયેલા એ સપીલા સ્પર્શની ધૂજારી ઘટતી નથી
 લીલા સાપ સરકવા માડે છે મારાં સતાનોની વરચે ગમે ત્યારે
 !
 લાલ રંગને જોઈને ઉબકા આવે છે
 અને લાગના ટોલ સીધા મારી છાતી પર જ પીટાય છે
 શરણાઈ સાંભળીને થાસ ગુંગળાવા કેમ લાગે છે ?
 છેડાછેડીનો એ હુકડો તો કયારનો ફંકી દીધો છે ને ?
 તો ખીંટી પર આ શોનો આભાર લટક્યા કરે છે ?

'સુખ'
એ પ્રાગએતિહાસિક કાળના શબ્દ છે મારે માટે
અના અવશોષોને
સાચવી - સાચવીને
સ્થળિયમાં ગોઠવ્યા છે મં
કાચની કેલિનેટમાં
અને રિપર
તકતી લગાડી છે
"Fregile-Do Not Touch"

સાંજને ઉંબર આવ,
આપણો રમીએ થોડું અંગત-અંગત
પોતપોતાનાં મહોરાં ચીરી
માકી જોઈએ સાચી સંગત

તું ડરવાનું છોડી દે
હું ભાંગી નાખું બ્રમ બધાયે
છલનો ટાંકપીછોડો છોડી
અપેક્ષાઓના બંધન તોડી
અવલંબનનો અર્થ શોધીએ
જઈ તે ક્ષણને વિસરી જઈને
વિશ્વાસની વ્યાખ્યા ફરીથી લખીએ

જૂનાં નામ હું ભૂસીં નાખું
લીટા બધા લૂઠી નાંખું
કોરો કડકડતો કાગળ લઈએ
એક-બીજાની સાથે રહીને
નવી જ કોઈ રચના કરીએ

કૂટેલા-કૂટેલા ટુકડા
કોઈક કાળા -કોઈક ઉજળા
એક પેટીમાં મૂકી દઈને
ઊડી ઊડી નામ વિનાની એક નદીમાં વહેવા દઈએ

સાંજને ઉંબર આવ,
આપણો રમીએ થોડું અંગત - અંગત.....

આકાશ ક્યારેય તૂટી પડતું નથી
 નથી બે ઘરોને જોડતા રસ્તા જમીનની અંદર ઉતરી જતાં
 યથાવત્ રહે છે બધું જ
 સંબંધો તૂટે છે ત્યારે
 માત્ર તમારા હાસ્યમાં એક વધુ તિરાડ પડે છે
 આંસુથી કાળા કાળા ડાઘ પડતા જાય છે
 ઓરિકાં ઉપર અને આંખ નીચે
 એકાંત નહોર ભરીભરીને ઊરડા પાડતું રહે છે
 અને
 ઘવાયેલું અભિમાન
 આસપાસ એક કિલ્લો ચણી લે છે - અભેદ
 સ્મરણોના, સંવેદનોના આધારે
 એક વેદનાની વેલ ચઢતી જાય છે
 ઝૂલ્યા કરે છે - રાત - દિવસ
 ભાથામાં શબ્દો ખૂટતા જાય છે
 પડા
 તક મળે એટલે તીરની જોમ છૂટે છે
 બરાબર મર્મજું નિશાન સાધીને
 હું અને તું બની જઈએ છીએ
 અર્થ વગરના સંભાપણોનો એક કોસ
 જેને ભોંચકીને જીતે જ જડાઈ જવા માટે આગળ ને આગળ
 વધતાં
 જઈએ છીએ !
 ઘડિયાળના કાંટા દરેક મુલાકાત વખતે
 વધુ ને વધુ ધીમા ફરતા લાગે છે
 અને છેવટે બ્રહ્માંદ્ર છૂટે છે
 આખાયે બ્રહ્માંડને રસાતાળ કરીને
 આપડા એક પડા ધા બીજાને નથી દેખાયો
 એનો પાશવી આનંદ લઈને ચાલી નીકળતી વખતે
 પાછળ ફરીને જોવાની હિંમત પડા નથી દેખાડી શકતા

લાગણીઓ - વચનો - ક્ષણો અને સંબંધો
 બધું જ ચૂર ચૂર થઈ જાય છે
 અને છતાં
 આકાશ તો નથી જ તૂટી પડતું.

હું પૃથ્વી,
મારી ધરી પર સ્થિર થવા મથતી,
બીજાના અસ્તિત્વો
ટકાવી રાખવા
મારે સ્થાને અવિચણ
કાટિબદ્ધ !

તુ -
આકાશ - પાતાળ
મારી આરપાર
મને વીધતો....
એક અસ્થિર અવકાશ
બીજો કથાતિત આભાસ
અને છતાં,
આપણું બ્રહ્માંડ
એક - અવિભાજિત
અનિવાર્ય !

મને હજ્જીયે સંભળાય છે
 ગરમ ગરમ થાસનું એ લયબદ્ધ સંગીત,
 તારા પ્રત્યેક ચૂંબનાની સાથે
 મારા હાથમાંથી સરકતી ગયેલી
 રેશમી મુખવટાની લગામો,
 તારા દરેક આલિંગન સાથે
 મેં મારી આતને તારી વધુ ને વધુ નજીક,
 તદ્દન - નજીક
 અનુભવી હતી..
કુષ્મસ બધું જ હટી ગયું હતું
 ન
 એ જાકળભીની સવારના સ્થૂરોદ્ધય સમયે
 મેં
 તારો હાથ મજબૂતીથી પડીને
 ઘસઘસાટ જેંધી જવાની ભૂલ કરી
 મને લાગ્યું કે તારા વિશાળ બાહુ પર મૂકાયેલું
 મારું માથું તદ્દન સલામત છે
 કમરામાં પડા ખેંચીને કરેલા આછા અંધારામાં
 મને લાગ્યું કે
 તડકો હવે નહીં જ પડે
 પણ..
 ...સવારે
 મને સમજાયું
 કે
 એ આખીયે ઘટના
 જિદે ચડેલા બાળકને મનાવવા માટેની
 'મેર્યાર' અને 'સાવધ'
 રમત માત્ર હતી
 હતી ને ?!

કેટલીયે સદીઓથી

હું

રાહ જોઉં છું !

આપણા અદ્વૈતની એ આલિંગનબજ કણાની...

...જ્યારે

તારીયે જાણ બહાર - ચૂપકીદીથી,

હું

સૂક્ષ્મ બનીને

મારી અંદર દાખલ થઈ જાય,

મારી નસ-નસમાં વહેવા લાગે,

એક આકાર બનીને - અદીઠ છતાં, અનુભવી શકાય તેવો

મારા જ્ઞાસથી થસે,

મારા લોહીથી વધે,

મારા હાડ-માંસથી ઘડાય....

...હું - ફરી એકવાર

કેટલીયે સદીઓથી હું એ કણાની રાહ જોઉં છું !

મારા આખાયે 'હોવા'પણાને ભૂંસીને

એક નવા જ સ્વરૂપે નવઅવતરણાની કણા !

તું અને હું, છીએ - રહીથું....

એવો વિશ્વાસ આપતી

બે નાનકડી ચમકતી કીકીઓ વરયે

ગીબરાતી આપણા જ્ઞાસના સત્યની કણા !

તારા પુનર્જન્મની એ કણાં

મને અંગ-અંગને ચીરી નાખતી

મેઘધનુષી વેદના આપીને

ઉફણાતા જ્ઞાસની વરયેથી

સમગ્ર અસ્તિત્વને ફાડીને

નીકળેલી મારી ચીસના આઠમા સૂર સાથે

એકસૂર થઈ જાય....

...તારું પ્રથમ રૂદન !

જે રોજેરોજ પ્રગતે પદ્ધી,

વિશ્વની તમામ ભાષાઓના સૌથી ઉત્તમ કાવ્ય - મારા હાલરડાંના રૂપમાં,

....હું કેટલીયે સદીઓથી એ કણાની રાહ જોઉં છું !

મારા સતનમાંથી

મારા અસ્તિત્વને વિકસાવવા માટે જ, માત્ર

અહુમને ઓગાળતી અમૃતધારાથી

ભીજાઈ જતી મારી કાંચણીના બંધ બાંધતી વખતે

ચચરી ઉઠે જ્યારે,

તારા પ્રથમ દંતક્ષત !

તારા મેલા - ઘસાયેલા ઘૂંટણ

અને

લાળના ફીઝાફીઝા ભરેલા સિમતમાં દૂબી જાય

મારું કહેવાતું 'સત્રીસહજ આકર્ષણ' !

તારી આંખના મોતીથી

ધોવાઈ જાય મારી આંખમાં દેખાતું આભાસી 'આમંત્રણ'

!

હું

મારા ખોળામાંથી નીકળીને

જ્યારે પહેલી વખત

આ ધરતીની સખ્તાઈ અનુભવે

ત્યારે,

બે-ચાર કણાના વિરહ પદ્ધી

વળી પાછા, મારા બાહુપાશમાં લપાઈ જવા માટે

તારાં વિષ્ણવળ, ટગમગતાં ડગલાં

મારી - માત્ર મારી જ તરફ આવે

એ કણાના સુખની કલ્પના હું સદીઓથી કર્યાં કરું છું !

આપણે સાથે ગાળેલી

તારા ગરમ - ગરમ ઉચ્છવાસોથી સભર સળગતી

અને

મુલાયમ અંધકારમાં પ્રત્યેક સ્પર્શો પિગળતી

તમામ કણાં મેં સંઘરી રાખી છે

ચાલ,

આપણે ઘડીએ એક આકાર....

...આપણા અદ્વૈતની કોઈક આલિંગનબજ કણે !

કેટલીયે સદીઓથી હું રાહ જોઉં છું !

પાંખ ફુફડાવી જોવા માટે
જરા...ક જેટલા અવકાશની માગણીના બદલામાં
આખું આકાશ આપ્યું તે - સાવ અડોઅડ
ચપટી ભરીને સ્થિત માર્યું મેં
અને
તે સુખનો ઠગલો કરી દીધો
મારા ખોળામાં !
તે મને એટલું બધું
એટલી સહજતાથી આપ્યું છે
કે હવે
તારી પાસે કશુંયે માગતાં હું ડરવા લાગી છું.

તારા માટેની મારી ઝંખના
 રગ-રગમાં સર્પના દંશ જેવી તીવ્રતાથી વહે છે
 વહ્યા કરે છે
 અને તું...
 મારા સ્ત્રીત્વને - મારા અસ્તિત્વને
 નકારે છે સતત,
 કેટલી સભાનતાપૂર્વક - કેટલી સરળતાથી !
 તને ઝંખવાથી તને પામવા સુધીનો રસ્તો
 અત્યંત લાંબો, અંધારો અને એકલવાયો છે
 (એ તને ખબર છે ને ?)
 અને તોય,
 સામે છેડે મૃગજળનું છલનામય અસ્તિત્વ લઈને
 શું કામ મને ઘેંચે છે ?
 શું કામ મને ઉગારી લેવાના આચાસનો આપે છે -
 - અનિશ્ચિતતાના કળણ પર ઊભો ઊભો !
 તું અસીમ જલનિષ્ઠ છે એ સાચું
 છેવટે તો દરિયો જ ને ?
 એક અજંલિ જેટલી જ,
 પણ મારી તરસ....

આવ,
તાને હું મારા ભાગનું આકાશ
પણ,
આપી એટિં...
તારા જીંયાણો
સર્વોપરી હોય,
સરળ સાધ્ય બને,
અને
ચિરંજિવ સ્થિર થાય એ માટે
હું પ્રાર્થના કરીશા...
મારા પગ
જમીન પર મજબૂત ટેકવી
તારા
પ્રવાસની પૂણ્યાદૃષ્ટિની
પ્રતિક્ષા કરીશા..
તું પાછો ફરીશા ને ?
મારી પાસે...
મારા માટે..
કયારેક તો !!!

મારા વિનાના શહેરમાં - તું શોધતો ફરતો તને
તારા વિનાના શહેરમાં, અહીં...હું - મને શોધ્યા કરું.

તેજ સુસવાટા હવાના - તોય અહીં ઉકળાર છે
હાજરી જ્યાં હોય તારી, બધેય મુશળધાર છે.

હું તડપું મીન - મારા થાસ પણ ઉધાર છે
'દમયંતિનો સ્પર્શ' - તું, સંજીવનીની ધાર છે.

તા. રૂનો સૂરજ
સોનેરી રંગનો ઉગશે

મારા લાલ ચહેરક પાનેતરની આભા
મારા ગાલ ઉપર જીલમીલ થશે !
આખુંયે મેધધનુષ તારી આંખોમાં ઉતરી આવશે.

જે દિવસની, મેં હરકણ રાહ જોઈ છે
એ શુભ દિવસની
કો'સદ્ગ્રામાણી કણે
હું અને તું મટીને 'આપડો' બનીશું.

એક બંધન બંધાશે અભિનની સાક્ષીએ,
એક સેતુ રચાશે સંવાહિતાનો.. મજબૂત !
તારા બેફીકરા - મનમોજ અને નિરવ જીવનમાં
ભલી જ્શે મારા ઝંઝરનો ઝનકાર અને મારી ચૂડીનો
ઘનઘનાટ

તારા રણકતા હાસ્યની છોળથી
ઝળહળી ઉઠશે મારી મખમલી રાત્રિએ
તારી કોમલ અંગૂલિના સ્પર્શો
મારા મનના કોરા કાગળ પર હું આલેખીશ
એક નામ - તારું !

તું - આકાશ
ખુલ્લું આકાશ
વાદળાયું - કોરં - ધાકોર
વરસ્યા વિનાનું
નેહું -
ધરતી !
મરુધરા !

આપણો સંબંધ....
...બીજગાણિત - ભૂમિતિના ચોક્કસ સમીકરણો છ.
એમાં ભાષાના વિલાસને અવકાશ ક્યાં ?

અંધારા કમરામાં
ચારે તરફથી દીવાલો ખસ્યા કરે
તમારી નજીક ને નજીક....
...એટલી, કે તમને તમારા જ ચાસ પાછા અથડાય !
એવું અનુભવ્યું છે કોઈ દિવસ ?

તમારા ગળાને રૂંધીને
ગરમ - ગરમ પાણી
રાતભર તમારું ઓશિકું ભીજવે
કાળાં કુંડાળાં પડતાં જાય - આંખ નીચે ને ઓશિકા ઉપર...
ભીની આંખોમાં રાત ભડકે બળે
એવું જોયું છે - કયારેય ?

મરબપોરે
કોઈકે બારળું ખખડાવ્યાના ભણકારાથી
સફાળા આગીને દોડો...
...અને નિર્જન આંગળું તમને ગુંગળાવી મારે
ત્યારે શું થાય - ખબર છે ?

એકાંત બહુ બૂરી ચીજ છે - દોસ્ત
એનાં પારખાં ન હોય !

જ્યારે જ્યારે તું આસપાસ હોય છે
જ્યારે જ્યારે તારો સ્પર્શ થાય છે

ત્યારે - માત્ર ત્યારે જ,
હું સજીવ હોઉં છું
મારા હોવા વિશે સંપૂર્ણ સમાન
મારા આસ્તિત્વ, મારા અર્થ વિશે સળગ !

તું આખું આકાશ છે મારું
અને હું એક વિહંગ
મારા ઉક્યાનનો આધાર છે - તું
વિસ્તાર છે તું જ મારી ચેતનાનો

હું તો સૂરજમુખી છું
મારી દિશાનો નિષ્ઠાપક ઝળહળતો સૂર્ય છે - તું !
મારી અંદરના બરફને પિગળાવીને
ધસમસતો ધોધ વહાવી શકે છે - સંવેદનોનો
તું - માત્ર તું !

આકાશ અને સૂર્ય તો એક હોય..
પંખી અને સૂરજમુખીનું શું ?!

બાળપણમાં ભેટ મળેલી
પરિકથાઓની ચોપડી
જીજું-શીજું હાલતમાં -
છતાંયે,
આજે પણ સાચવી રાખી છે - મેં !
એકદંડિયા મહેલમાં
પૂરાયેલી રાજકુમારીને
છોડાવવા આવતો રાજકુમાર
એમાં સફેદ ઘોડા પર સવાર તો થયો છે
પણ એનો ચહેરો ફાટી ગયો છે
વારંવાર વાંચેલી એ વાતામાં
શબ્દેશબ્દ મને યાદ રહી ગયો છે
પણ
રાજકુમારનું નામ
કુમેય કર્યું યાદ આવતું નથી
નામ કે ચહેરો....
.... મળશે ખરાં ?

જવા દે દોસ્ત,
 તું થાકી જઈશ,
 મારી મૂળ રંગોની ઓળખ જ ઝાંખી થઈ ગઈ છે
 મને મેળવકી શિખવવાની જુદ શા માટે કરે છે ?
 મારી લગભગ ઠીંગરાઈ ગયેલી
 સુષુપુમ સંવેદનાશીલતા
 હવે માત્ર સ્થૂળ સ્પર્શની જ ભાષા ઉકેલી શકે છે
 મને - પ્રકરીને ચૂંથી નાખીશ
 ત્યારે માંડ તારી હાજરીની નોંધ લઈ શકીશ હું
 મારી અપેક્ષાઓનું લિસ્ટ વાંચતાં-વાંચતાં
 તારી આતને ખોવા લાગીશ તું
 અને
 આ બધા પદ્ધીયે
 માની લઈએ કે તું મારા સુધી પહોંચી પડ્યા ગયો તો
 શું તારી બધી જ લાગણીઓને
 યથાવત ફોળી શકીશ મારી ઉપર ?
 ત્યાં સુધી ?
 જવા દે દોસ્ત, તું થાકી જઈશ !

સૂની સેંથી પર તું અમથું ઝૂક્યો
ને મારી નસનસમાં સિંદૃપ્તિયો રંગ.

સૂકી આંખોમાં મારી ટળવળનાં માછલાં
તારા સ્પર્શમાં દમયંતિનો હંગ.

સોનેરી આંખોથી છાલક મારી તે
જળકજળક થાય મારા અંગ.

રેખાઓ હથેળીમાં આળસ મરડે
ને મારી સેંથીમાં ઉધડે સવાર.

પાછલી સફરની મારી લાંબી-સૂની
રાતોની યાદ નથી બાકી લગાર.

ખુલ્લું આકાશ... આધારહિન.. અવકાશ... મારી ચોતરફ
આપણા સંબંધની ઓટમાં
મારા પગ નીચેથી સરકે રેતી... કણા... કણા...

મુક્કીમાં પકડીને જોવાની જણ - મને,
તું તો રેતી - કણા... કણા..
પાછળ ફરીને જોવાના પ્રયાસમાં - આંધી.... કણા... કણા...

ખોબે-ખોબે પીધાં ઝંજવા - જિંદગીભર
ગળા નીચે સતત - રેતી.. કણા... કણા...

સાપની જેમ
વીટળાયેલી
તારી
સ્મૃતિ
અને
લાગણીઓ મારી કંચળી ઉતારે.

કું પૂરેપૂરી આલિમ
અને
કું - લિમ તારામા.

તારી - મારી વર્ચયે
મોન
વિનાસકીન જેવું
જરાક અમથો
શાયદના ધક્કાઓ
ને
બધું ચૂર.. ચૂર...

તારી આંખોની ભાષા
મને શ્રીક-લોટિન લાગે છે
બુમો પાડીને કહી દે
એક માત્ર એકવાર
મને સમજાય એવી ભાષામાં
કુ
કુ મને માત્ર મને જ ચાહે છે.
મારા શાસ ઘીઠીએ ટીંગાઈને
મારી ચેતનાના જગવાની રાહ જોઈ રહ્યા છે.

‘શક્તા તો સ્વભાવે જ અંધ !
ને પ્રેમ પડા !
તું તો સંજ્ય - દિવ્યએણ !
ભૂલી ગયો ધૂતરાષ્ટ્રની શક્તા, તારામાં ?
ધમીક્ષેત્ર - કુરુક્ષેત્રની એ વાત્મ -
હું અને તું !

મારી અંદર - બહાર
 આસપાસ - યોપાસ
 મને ધોરે છે
 મારા હોઠથીયે વધુ મસૂષા
 મારા ટેરવાંથીયે વધુ સંવેદનશીલ
 મારી આંખથી વધુ તોફાની
 એક નામ... અને તું!
 તારી અને મારી વચ્ચે
 મૌનનો લાંબો - બફીલો રસ્તો
 સૂરજની ઉગવાની રાહ ઓતી હું... અને તું?
 સાત રંગના કુમ્મસનો
 સુગંધી દરિયો
 દરેક રંગમાં તારું સ્મરણ
 દરેક ચાસમાં તારી સાથે ગાળેલી કાણોની સુગંધ
 મને ખોઈ રહેલી હું અને....તું!
 મને ચાહી શકવાની
 તારી અક્ષમતા (કે અણસમજ)
 તને ચાહવાની મારી મજબૂરી
 અટવાતી આવતીકાલ
 હું... અને તું!
 સાથે ગાળેલી કાણોના ગુણાકાર
 જુદાઈના દિવસોની બાદબાકી
 લાગણીઓના સરવાળા
 અને
 સ્પષ્ટતાના ભાગાકાર
 આપણા સંબંધનું સરવેયું
 ભાપાના વિલાસમાં દૂબતી હું... અને તું!

આકાશમાં ઓગળતા
 અવાજના
 અડાબીડ અવકાશમાં
 વાદળોના ડગલા જેવો..
તું!
 ક્રેટલીક સાંજે
 સાવ અમસ્તો
 આથમતા સ્વરજના ગોળાની સાથે
 મારી ભીતરમાં ઓગળી જાય છે....
તું!
 ઉનાળાની
 હૂંફાળી રાત્રે
 મારી ઠંડી ઠંડી ચાદરમાં
 સુગંધ બનીને મહેંકે છે...
તું!
 લાલધૂમ વહેલી પરોહે
 શમણાં ખનકીને તૂટી જાય
 ત્યારે,
 મારા સુક્કા-તરસ્યા હોઠ
 ઝાકળ બનીને ભીજવી જાય છે...
તું!
 મારી એક - એક ક્ષણનો
 હિસાબ -
 મારા શાસનો લયબદ્ધ ધબકાર....
તું!
 કોઈકની સાથે વાત કરતાં
 મારું સ્વિત બનીને
 મારી આંખની ભિનાશમાં
 જળકી જાય છે...
તું!
 મારા આસ્તિત્વનું એકમાત્ર કારણ
 મારા સજ્વ હોવાનો અહેસાસ
 મારી લાગણીઓની પરિભાષા
 ...તું - માત્ર તું!
 ઉનાળાની બળતી બપોરમાં -
 શિયાળાની કાળી અંધારી રાતોમાં -
 વરસાદની તોફાની - ભિનાશમાં -
 ...તું -
 જંયું દૃંઘ.. અને મારી પાસે નથી હોતો.....
તું!

તારી રાહ જોઈને
મારી ધીરજના વૃક્ષ ઉપરથી
એક એક પાન ખરતાં જાય છે
તું મને આલિંગન આપે છે
ત્યારે, એક સુકું થડીયું હોઉં છું - હું !

હાથ લંબાવને, જરાક....
....મારી અંદર જે સતત બળે છે
એને માત્ર તારો સ્પર્શ જ ઠારી શકે.

તું ઘેરાયેલો
અને હું,
વધુસ્તંભ ઊંચકીને
આગળ....આગળ....
સાવ એકલી !
મારા સુધી આવ
તારો અવાજ
પણ હવે તો...
આગળ...આગળ....

મારી અંદર
ખીચોખીય બારુદ ભરી દીધો છે
સતત સંભાળાયા કરે છે
પળે પળે આગળ વધતી
ગોઠવેલા સમયની ટીક.. ટીક... ટીક....
લાલ-લીલી બતીઓ
સમય - સમયે જબૂકયા કરે છે - નિયમિત,
ભૂલેચૂકે મને આલિંગવાનો પ્રયાસ નહીં કરતો
નહીં તો.....

મારી અંદર ક્યાંક - કોઈક ખૂણે
આજે પણ એક ભીની રાત જવે છે.
એકાંતમાં - લપાઈ - છૂપાઈને
એની સુંવાળપને અડકું
ત્યારે
સાપની ચામડીને અડક્યા જેવો
ભયનો ધ્રાસકો પડે છે.
એની તેજાબી ભિનાશની છાલક
મારી આંખમાં ન ઊરે
એનો ડર
મને સતત સતાવે છે.
રેતીના નગરમાં
વગર સિંચ્યે સંવેદનાઓની વેલ વધતી જ જાય છે
હવે, જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી છે, એ રાતને,
મૃગજળના કુંજાને
હું - તમે કે બીજું કોઈ પણ
ક્યાં લગી સાચવે ?

કોઈ ચાલ્યું જાય

કે

તમે છોડી આવો, 'કોઈક'ને,
અનાથી કશ્યું જ બદલાતું નથી
ફેર્ડમ તોડીને બહાર આવતા જ રહે છે - ફોટોગ્રાફસ
ચાદરમાં પણ ગંધ રહી જતી હોય છે કોઈકની !

માણસના અસ્તિત્વને

કેવી રીતે લૂધી શકાય દીવાળો ઉપરથી ?

આસપાસની હુનિયા વાધ-વરુની હોય કે,

હરણ-સસ્તલાંની

સંબંધોના જંગલમાં - અડાબીડમાં

દિશાશૂન્ય ક્યાં સુધી ચાલી શકાય ?

સાવ અચાનક,

સુકકા ગુલમહોરની જેમ

વર્ષો સુધી કિતાબમાં બંધ રહેલું, કશુંક

ખરી પડે

ને અનાયાસે

તમે ચાસ લઈ બેસો

તો

સુગંધની ગેરહાજરી માટે

ગુલમહોર કે કિતાબને દોષી ઠરાવી શકાય ?

તમારા રોજિંદા એકાંત રસ્તા ઉપર

સાવ એકલા જ ચાલ્યા જતા હો

ને રસ્તાના વળાંક પર 'કોઈક'

સાથે લઈ જવા છું પકડે તો ? - કેવું સારું !

ને વર્ષો સુધી પાનાં ઉથલાવીને થાક્યા છતાં

ગુલમહોર ન યે ખરે

રસ્તો

સીધેસીધો ચાલ્યા જ કરે.....

એવુંયે બનો કે વળાંક આવે જ નહીં.

સહરાની તરસથી કોઈને ચાહવું એટલે શું ?
મૃગજળની જેમ કોઈને પામવું એટલે શું ?

કુમસની જેમ કોઈને આણવું એટલે શું ?
છાંયડાની જેમ કોઈને માણવું એટલે શું ?

રડકાની તીવ્રતાથી કોઈનો સ્પર્શ થાય - એ શું ?
ઝાકળની જેમ કોઈ વરસી જાય - એ શું ?

વૃક્ષની જેમ સતત ઝૂકી જવું એટલે શું ?
જિંદગીને સિગરેટની જેમ ફૂંકી જવું એટલે શું ?

છોડ બીજા બધા સવાલ -
તારો ને મારો સંબંધ એટલે શું ?

લાલ ચૂડી
 લાલ ઘરચોળું
 કપાળમાં લાલ ચહુખ સૂરજને કેદ કરી
 આંખમાં રાત આંજને
 સોળે શાણગાર સંજેલી મુંધા જ,
 નવોદા - નવવધૂ હોઈ શકે ?
 કહેવાઈ શકે ?
 તો,
 પ્રિયતમના પ્રથમ સ્પર્શની અનુભૂતિ પદ્ધી
 વિભરાઈ જતી
 લજવાઈ જતી
 ઘઉંવણ્ણા લાલ પરની લાલ ચહુખ આભા
 અને
 આંખમાં શમણાં આંજેલી યુવતીને
 શું કહેશો ?

'વાઈળ ધેરાય, છતાં વરસાઈ ન આવે'
 એવી અનિશ્ચિતતા - તરસ - બોયેની
 હંમેશા આપણા સહવાસની કાણોમાંથી પડઘાય છે.
 મારી અપેક્ષાઓની પછાટ
 શબ્દોની પાળ તોડીને ગાંડીતૂર વહેતી જાય છે
 અને તું!
 નિર્લેખ - નિર્વિકાર
 તારી રેતાળ આંખોથી
 કોણ આણો, આટલું બધું શું... શા માટે કહે છે ?
 મારી આસપાસ
 એક તોતિંગ - મજબૂત દીવાલ
 નજીક... વધુ... નજીક... વધુ ને વધુ નજીક ખસ્યા કરે છે.
 મારી ગુંગળામજા વધતી જાય છે.
 મારી જાથે જ ભીસાઈને
 ચૂર ચૂર થઈ જશો
 મારી બધી અપેક્ષાઓ !
 અને છતાં,
 તારી રેતાળ આંખોમાં રકા વિસ્તાર્યાજ કરશો ?

મુગજળમાં જળ નાખ્યા કરવાથી,
માદળાં ન મળે....
આંસુ વાવવાથી,
મોતી ન ઓળે....
અને
જાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય....
...આવા અનેક સત્યો સંબંધની શરૂઆતમાં સમજતાં હોત
તો ?

આપણી વર્ષે
આડી દીવાલ સમજાની !!
હું તને કહું મારી વાત,
મનથી - લાગણીથી - હદયથી
ને હું....
સ્પર્શ વિના બીજું કંઈ ન સમજ ?

કેસરી અજવાસ
ભીનાં ભીનાં ઘાસની લીલીછમ પથારી
ધુમ્સઘેરી ભૂરી ભૂરી ઠંડક
ને હુ.... ર સુધી એકાંત
તું કેમ યાદ આવે છે-ક'ટાજો ?

મેં સૂરજમુખી માગવા માટે
 ડરતાં ડરતાં લંબાવેલા હાથમાં
 તે
 આખેઆખો સૂરજ મૂકી દીધો છે !
 વહેંત જેટલી જગ્યા માગી હતી - મેં,
 તારી અંદર - ક્યાંક - કોઈક ઘૂણો
 અને તે -
 મને ઘસડીને, તારી રગરગામાં વહેતી કરી નાખી છે.
 પાંખ ફફડાવવા જેટલા અવકાશની માગણીના બદલામાં
 ગણતરીના ચાસ ઉછીના માગ્યા હતા મેં તો
 ને તું બ્રહ્માં લઈ આવ્યો, તારા બાહુપાશમાં !
 બે સ્થેત-ચાર ઘુણીની પળો ચાહી હતી મેં તો - માત્ર,
 ને તે 'ચુખ'નો હગલો કરી દીધો - મારા ખોળામાં,
 તું ક્યા હતો ?
 તું કેમ મને વહેલો ન મળ્યો ?

લોહીનો સંબંધ
 એક જન્મનું ઝણ માત્ર, બની ગયો છે
 એક વજનદાર ઉપકાર
 જેને વેંદારવાની ટેવ મને ધીમે ધીમે પાકી થવા લાગી છે
 હું ભૂલી જાઉં ક્યારેક
 તો યાદ કરાવી હેવાય છે - સહજતાથી.
 અને એટલેજ,
 હવે એક ઝણ ફેડવાની કુતી માત્ર બચી છે
 તારીખ વાર સહિતનાં
 ગણેલા ગણાવેલા અહેસાનો
 અને
 હું ધાવણ 'હલાલ' માત્ર !
 બે હોઠ વચ્ચેથી નીકળતાં
 રમતમતાં તીર -
 નાગી તલવારો સાથે
 સતત ઝૂંમતા - મરણિયા થતા 'અમે'
 હાલ ધરતી વિંધતી નિશાન સાધી વિંધી નાખતી હું !
 શ્રદ્ધા-વિશ્વાસ-સન્માન ને

પરસ્પર ભૂંસવા મથતા
 રોજ વધુ એક પગબિયું નીચે ઉત્તરી જતા - સૌ
 મારા સુકાઈ ગયેલા ઠંડાગાર સંબંધો
આમ જ પડી રહેલા
 અવાવરૂ ધર જેવા !
 ગઈ - જાળાં....સ્મૃતિ - વિસ્મૃતિનાં
 ચામચિડીયાના ફફડાટ, ક્યારેક.....
 કશું જ 'આપણું' નહીં, હવે
 હું અને 'તમે'માં
 પડધાય છે ખાતર - પાણીની ખામી,
 ખડખડાટ હાસ્યો
 અને

લાળલાળના સ્મિતમાં દૂબેલા
 કેટલાક BxW પ્રસંગો
 માત્ર *Photographic evidences !!*
 પોસ્ટકાર્ડ સાઈઝની નાનકડી ફેમમાં
 તણોય જણાં હજુ સાથે મુસ્કુરાઈ રહ્યાં છે.
 અને,

પાતાળકુવા જેવડી તરસના સવાલ સામે
જાકળનો જવાબ કેમ આપે છે તું ?
પાંખો તો કયાંક હું ખોઈ જ આવી છું
હવે પગના બંધન કેમ કાપે છે તું ?
રોમ રોમ મારાં જ્યારે ભડકે બળે છે
ત્યારે પાંપણાનાં પલકારા માપે છે તું ?
ભરડામાં કયાં લગી આમ જ ભીસાવું મારે ?
લીલોકચ દંશ એક આપ !
એક સાથે ઝેર બધું રગરગમાં ઠલવી હે
મને મરવા તો હે - મારા સાપ !

આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું ?
 રંગરોગાન વગરના સંબંધનો ચહેરો
 પહેલીવાર ધોધમાર અજવાળામાં
 આંખ સામે ખૂલ્લી ગયો.
 તું.... જાણો સામે કિનારે
 અને તારી આસપાસ નાચતી નિર્વસ્ત હકીકતોની ભૂતાવળ
 આ કિનારે એકલી-અદૂલી હું.
 મારા બિસ્સામાં મારી અપેક્ષાઓ - અધિકારોનું ચુંથાયેલું
 લિસ્ટ
 કહેલા - ન કહેલા, માની લીધેલા શબ્દોના લીરેલીરા
 આંખમાં રેતી ને હોઠ પર ઝંગવાં,
 આપણી વચ્ચેના પુલને
 ફૂર્યોફૂર્યા થઈ ઊડી જતો જોઈ રહ્યા છીએ
 આપણો બંને - અસહાય !

આપણી વર્ષે
 અચાનક
 આ શું થઈ ગયું?
 તને મારું ઘર હૂર લાગે
 ને
 તું મને અજાણ્યો.
 બે જુદી જુદી સરહદો
 બનીને ઉભેલાં
 આપણી વર્ષે
 વધતો જતો
 'નો મેન્સ લેન્ડ'નો પક્કો.
 મને સતત ભય-આઘાતનો
 તું સ્વબચાવની પૂરી તૈયારીમાં
 ને છતાં,
 સમજૂતીની સુફીયાણી વાતાં
 ને
 અચાનક
 મૌન....
 કરારોના ફરફરિયાં
 ને
 ખાલી વાતો - ખાલી વાતો
 હજુ હમણાં જ ગઈ એ કાણ
 ત્યાં સુધી તો આપણો મિત્રો હતાં - હતાં ને ?

તારા વિના આ શહેરમાં સૌ અજાણ્યા લાગે મને
આ હવા - આ સાંજ કેમ શૂળ થઈ વાગે મને?

મારો જ ચહેરો આઈનામાં જોઉં તો પરખાય ના
આકાશ ચોધારે રડે ને તોય મન ભીંઝાય ના.

મારી અંદર ધસમસતી જતી
 આ વેદનાની નદી
 અને, એના બંને કિનારાઓ વરચો વહેંચાયેલું મારું
 અસ્તિત્વ...
 સમાંતર કિનારાઓ વરચો
 સમતુલ્ય જાળવી - જાળવીને જીવતાં
 હું હવે થાકી ગઈ છું.
 મારી વેદનાની આ લગ્નાતાર યાત્રાને
 હવે અંત ઓઈએ છે.
 એક એવો મહાસાગર....
 જેને મળીને, જેમાં ખોવાઈને
 મારું અસ્તિત્વ વિલાઈ જાય,
 એક એવો દ્વિપ
 જેના પર આધારિત રહી શકાય
 એ દ્વિપ પર
 એક વૃક્ષ
 જેને વિંટળાઈને સાચવું મારું અસ્તિત્વ
 મને ઓઈએ છે,
 એક એવું નામ
 જે મને - મારા નામને
 કોઈ અર્થ આપે.
 એ મહાસાગર....
 એ દ્વિપ...
 એ વૃક્ષાં...
 એ નામાં...
 હું બનીશ ??

તને પ્રિયતમ કહેતું મને ફાવતું નથી
પણ નામ હવે બીજું જલે આવતું નથી.
એકવાર અમથી તે ચૂમી ભરી છે - પછી
ગળપણના નામે બીજું ભાવતું નથી.

મારા વિનાના શહેરમાં તું શોધતો ફરતો - તને
તારા વિનાના શહેરમાં અહીં હું મને શોધ્યા કરું.

જાણો ગુંથાય સેરમાં જ્યારે રહે તું આસપાસ
તારા ગયાની જાણ પદ્ધી હું એક એક તોડ્યા કરું.

પ્રત્યેક જાણ લાગ્યા કરે, તું જઈશ...કે, તું ભાય છે,
હું નિઃશબ્દ આમ જ, તને બસ આંખમાંથી રોક્યા કરું.

તું વજનદાર મૌનના ખડક નીચે દબાયેલો
હું તને ઉગારવા સતત કંઈ ને કંઈ બોલ્યા કરું.

ઈટ-પશ્ચરના મકાનોમાં તને વસવું ગમે
રેતીના હું ઘર - પદ્ધી ઘર ચણતી રહું....તોડ્યાં કરું.

કેટલી સદીઓ સુધી હું હજુ પ્રતિક્ષામાં રહું ?
આ જ પ્રશ્ન કેટલી સદીઓ સુધી પૂછ્યા કરું ?

સંબંધોની ચાડી
ખાય ચીસો પાડી
સામે દીવાલ આડી
રોકે ભૂમો પાડી
અરરર... માડી.

વારતા રે વારતા
ભાભા ઠોર ચારતા
મનને મારતા
છોકરીને વારતા.

હવે ન છોકરી રિસાતી
બસ, જમજજા પાછળ તિંસાતી
સતત દીવાલ આડી
રોકે ભૂમો પાડી
અરરરર. માડી.

જવતા-મરતા
ઉઠતા-પડતા
દરેક હથોડા સાથે જાણો બચવા માટે કરગરતા
સંબંધોની વારતા
વારતા રે વારતા
ભાભા ઠોર ચારતા.

તું હવાની જેમ મારી આસપાસમાં હોય છે,
બંધ પાંપક્કામાં સતત, મારા પ્રત્યેક શાસમાં હોય છે.

સતત વરસતાં વાદળો જેવો સંબંધ આપકાં
મેઘધનુષ્ય આપકો મન બિનજરૂરી હોય છે.

તમારી સાથે ગાળેલી એક એક ક્ષણ
 હવે સ્મરણ થઈને જવે છે.
 સ્મરણનો રંગ હોય છે - સુગંધ હોય છે.
 પડછાયોય હોય છે અને આકાર પણ હોય છે !
 એમાં વિતેલા - માણેલા દિવસોની ઝાંય હોય છે
 અને ન કહી શકાયેલા શબ્દોની લ્હાય હોય છે !
 સ્મરણમાં ઉનાળું તડકો હોય છે.....
 ..અને શિયાળું છાંય હોય છે.
 સ્મરણનો રંગ ભૂરો.....
 ...દરિયાના મોજાં જેવો - ધસમસતા, ધોંઘાટિયો, ધરો
 ગંભીર !
 ભૂરા આકાશ જેવો - નિગૃહ - અકળ - અણાઉકેલ્યો ને
 ઊડો
 મૃત્યુ પામેલા મનુષ્ય નખ જેવો - નિર્ઝવ - જડ !
 સ્મરણનો રંગ રાખોડી....
 ..સ્મરણની રાખ જેવો - નિર્લેપ, લાગણી વિનાનો -
 સ્મરણનો રંગ રેતી જેવો....
મુઢીમાં પકડો તો સરકી જાય - પાણી રેડો એટલું પી
 જાય !
 ..તરસ્યો,
 સ્મરણનો રંગ મુગજળ જેવો...
 ...છલનાભયો - સુકકો
 ભૂખ્યાની ભૂખ જેવો અને જેટલો તેજ
 તરસ્યાના કંઠ જેટલો તરડાયેલો.
 સ્મરણનો રંગ તૂટી પડેલા મકાનના કાટમાળ જેવો
 ...દબાયેલો - દટાયેલો ભૂતકાળ
 યાદના ટગલેઢગાલા.

જત જણાવાનું તને કે આમ બધું અહીં પહેલા સમું અકબંધ
છે
પણ નગરની શેરીઓમાં, સાંભળ્યું છે, કોઈ પણ અંકુશ
વિના
ચૂપચાપ ફરતો લોહી તરસ્યો રાની એક સંબંધ છે.

એક નાદી લાવાભરેલી, શાંત સરકી રહી છે એની પીળાચીઠી
આંખમાં સદીઓથી એની જીભ પર સૂતા રહેલા સ્વાદના
સર્પે હજુ હળવેકથી હમણાં જ લપકાવી છે એની લીલી
અછ્છવા

તંગ તાંબાની ફરકતી મૂછ ઝીલે છે હવાના કંપતા અક્કેક
ઈંગિત, હળવેકથી મોહું ઘસે છે, સાવ લગભગ ઘેનમાં, હવે
એ અચાનક માણું જીંયકી મારી આંખોમાં પરોવી આંખ
ટ્રાફ જીભો યંત્રવત
ને મંત્રમુંઘા, અધ્રમુંઘા સ્પર્શની કુંવરીઓ મારી
આંગળીથી શ્રાપ પ્રેરિત વપ દઈને ઘરતી રહે છે. સતબ્ધ
ત્યારે હું જડાઈ જાઉં છું વિસ્મૃતિની બારસાખોમાં મદાઈ
જાઉં છું અને કેં કરી શકતો આ નથી કેં પણ કહી શક્યો
નથી એ પણ નહીં કે આવ દૂબી જાઉં હું આવી સાવ એ
પહેલાં મને

શું કરું
નિઃશબ્દ પથરાયેલા આખા શહેરની બધીયે દીન્દ્રિયો હવે
મૂંગી છે, નકામી, અંધ છે.
પણ નગરની શેરીઓમાં, કોઈ પણ અંકુશ વિના ચૂપચાપ
ફરતો લોહી તરસ્યો રાની એક સંબંધ છે.

જત જણાવવાનું તને કે

આમ તો બધું અહીં અકબંધ છે

ઘવાઈને પડ્યો છે જે જ્ઞાણવાર પહેલાં

એ જુ, આપણો અંકુશ વિનાનો - લોહીતરસ્યો - રાની સંબંધ છે

એક ઓર બાળ મંડાઈ ગઈ છે, ચોપાટની માણસે મા'ત દીધી છે માણસને - જત પર જઈ.

સ્મરણોની સાંકડ-સંદિગ્ય - સંકીર્ણ ગલીઓ
સાપની જેમ જળવળે
ને, શ્રાપપ્રેરિત મંત્રમુગ્ધા - અર્ધદંગધા
ધૂટવા, વિસ્મૃતિની બારસાએથી - ટળવળે.
એક હરણું જો, હજાયું છે હજુ હમકાં જ
રમતિયાળ, રંગન એનાં ઠગલોક સપનાં તરફકુ.
રંગહીન - બફ્ફની ચાદર ફગાવી
'સાકાર' સ્પર્શોએ
આંખ ચોળી - આળસ મરડી છે, હજુ હમકાં જ.
માર તમાચો - દેખાડ એને,
સદીઓથી ભૂખી અષ્ટણાનો કંપ કેવો કરગારે.
ને, ચાર આંખોમાં

શાંત સરકતી,

એક નદી લાવા ભરેલી

ઉફણાય - અચાનક

કેસરી, ધોમધખતા રંગની જવાળા દાઢે
લાલધૂમ પરપોટા

ઝૂટે રૂંવે રૂંવે - ખૂડખૂડાઈ કરતા
ને -

શબ્દધવનિ અસ્પષ્ટ - અસ્કૂટ

અસંબંધ અથો સાથે

અવિરત

અટવાયા કરે આસપાસ.

એકમેકમાં ગુંથાઈ જવા તરફડતી

બે હથેળી હવે ગુંચવાય,

એના કુલો ફેરવાય

તણખા જરે સામસામા

ને

ગળું તરડાય

આંગળીના ટેરવે

અમસ્તા જ

ઝૂટી નીકળતા'તા જે ઉઘાડ

હવે

બુઢા - જડ છે - ચેતનવિહીન છે

ને

તોય, બાકી ક્યાંક હજુ બળતા માંસની હુગંધ છે

ઘવાઈને પડ્યો છે જે જ્ઞાણવાર પહેલાં

એ જુ, આપણો અંકુશ વિનાનો, લોહીતરસ્યો, રી સંબંધ
છે.

જ્યારે જ્યારે તું આસપાસ હોય છે
ત્યારે માત્ર ત્યારે જ
હું સજીવ હોઉં દું.

તારા બાહુપાશમાં બંધાયા પદ્ધી
શમી જાય છે
મારી બધી જ ફરિયાદો
મારા બધા જ અભાવો...
...અને,
ભવિષ્યનો રંગ
સોનાની રજમાં ભેળવેલા સિંદૂર જેવો લાગવા માંડે છે
તારા બંધ હોઠ,
તારી ખુલ્લી આંખોથી
મારા બધા જ વણપૂછાયેલા - ન પૂછી શકાયેલા
પ્રશ્નોના સચોટ જવાબો આપી દીધા છે - તે!
તું જ્યારે જ્યારે મારી તરફ જુએ છે
ત્યારે
ઠંડા પાણીની એક છાલક વાગે છે
મારા તપતા મન - માસ્તિષ્ક ઉપર
અને છતાં
સિન્દૂરલાની જેમ
મારા કાનમાં સતત વાગ્યા કરે છે ભણકારા
મધ્રાતના ડંકા વાગવાના.

આપણો કેટલું મયારી વિચારીએ છીએ !
 મારો ભૂતકાળ તું - 'તારો' બનાવી શકે એમ નથી.
 અને, તારા ભૂતકાળ સાથે મારો સંબંધ શોધ્યો જડતો નથી.
 આપણી પાસે કમભાગ્યે ભવિષ્યની 'નજર' નથી.
 (કે સદ્ગ્રાહી !) આપણો ભાવિ તરફ મીટ માંડી શકતા
 નથી.
 નથી આપણી પાસે વગર જાણ્યે, વગર જોયે, અનુભવ્યે,
 સાવ અણાઈઠી જમીન પર પગલાં માંડવાની હિંમત !
 એટલે જ વર્તમાનને લંબાવતા જઈએ છીએ ?
 આપણી વર્ષ્યે સતત હાજર હોય છે - અનાદિ.. અનંત....
 સુધી વર્તમાનકાળનો એક પછો !
 તું મારી અંદર વધતું જતું એક સ્થિર, અપાર્થિવક વૃક્ષ છે
 મારી રક્તવાહિનીઓ સુધી લંબાય છે તારી ડાળીઓ
 અને મૂળ મારી અંદર... ઊંડા.... વધુ ઊંડા....
 હું સતત સાંભળી શકું છું તારી પણ-મર્મર,
 અને અનુભવી શકું છું
 તારી અને મારી નજર મળેલી.
 ત્યારે ત્યારે,
 ભીની થયેલી મારી આંખો,
 શું ભીજાવું અને દાજાવું બંને એક નથી ?
 (તો મને અંગારાના ફૂલ કેમ આવે છે ?)
 હું બેફામ ઝંગાવત...
 અને તું,
 આકાશ જેવો ભૂરો-નિગૂઢ-અસ્પૃશ્ય એવો માત્ર અવકાશ
 સતત અકળ દૂર ને દૂર !

‘બધું જ મળ્યા છતાં,
જે નથી મળતું
અનો ઓથાર વધુ વજનદાર હોય છે.’

તમારી બે હથેળી ઓની વર્ચ્યે પકડેલો ચહેરો... પિગળવવા
માંડે!
અને અચાનક જ
એક ખૂબ જાણીતો ચહેરો હસી ઉઠે
એક જાણીતા બાહુપાશની ભીસ ઘેરી લે, તમને
અને, એક ઓળખીતી સુગંધ તમારા શાસ અટકાવી દે!
આવું બન્યું છે, ક્યારેય?

રેલવે પ્લોટફોર્મ પર

બસની - રસ્તા પરની ભીડમાં
એક ચહેરો દેખાયાનો આભાસ (તમે પણ જાણો છો -
માત્ર આભાસ)
કલાકો - દિવસો - મિહનાઓ સુધી બેચન બનાવી જાય
અને પછી
દરેક સ્થળે
બંધ આંખે તમે એ જ ચહેરો શોધવાની કોશિશ કર્યા કરો
છો ને?

સાવ અજાણ્યા માણસોના ટોળામાં
અજાણ્યા અવાજોના ધોઘાટમાં
એક જાણીતું નામ - અદ્દતું જ
તમારા કાને અથડાય,
અને, પરસ્નિલ ક્ષણોના આલ્બમનાં પાનાં ઉઘડવા લાગે.
એક પછી એક...
એ સંવેદનાઓમાં જંગલમાંથી રસ્તો કાઢતાં

થાકી જવાય,

અને
એ નામ, એ ચહેરો
તમને આહેરમાં મળે તો,
તમે ઓળખો છો
છતાં, ઓળખી નથી શકતા
મળો છો
છતાં, મળી નથી શકતા
અને ‘બધું જ મળ્યા છતાં,
જે નથી મળ્યું
અનો ઓથાર વધુ વધુ ને વધુ વજનદાર બનતો જાય છે’

સાવ અચાનક,
મારી અંદર કંઈક તૂટ્યું
અને
એક ઝાટકા સાથે
આસ્તિત્વ આખામાંથી
ધગધગાત લાવાનો ધોથું ફૂટી નીકળ્યા,
રૂંવે રૂંવે દાડાડે....
કણ કણાને બાળો... એવો!

ગરમ-ખારું પાણી
મારા ગળાને ભીજવતું
તદ્દન બેકાબૂ બનીને
મારા ગાલ પરથી વહ્યા કર્યું
ક્યાંય સુધી.
અને પછી બધું ઠરી ગયું.
મારી ચેતના સહિત!

હવે એક સખત આવરણ લપેટાઈ ગયું છે.
મારા મનને - મારી સંવેદનાઓને ફ્લૂરીને
એક કર્ડક કોયલું છે.
મારા આંખોથી મારા હોઠ સુધી
બધું સુકું ભટ છે.
રણની રેતી જેવું
મુહીમાં ભરો તો સરકી જાય,
પાણી રેડો એટલું પી જાય. 88
હવે ક્યાંય કશું સળગી ઉઠે એવું નથી
ને તોય,
દાઝ્યા કરે છે - સતત ઊર્દું ને ઊર્દું!

માણસ એટલે માણસ -
આ તો જીવનથી ભરપૂર
નશામાં ચૂર
પોતપોતાનાથી દૂર - એવો માણસ એટલે માણસ.

આ તો માણસ એટલે માણસ
જેને આરો કે સોવારો નહીં -
પાળ કે પદ્ધતથારો નહીં -
કોઈ મારો કોઈ તારો નહીં -
એનો પાસો કોઈ પોબારો નહીં -
આ માણસ એટલે માણસ.

આ છે માણસ એટલે માણસ
એની આંખથી છૂટે તીર
ને ખળખળ વહેતાં જાય નીર
એના જપનાં એવા અધીર
જાણો દ્રૌપદીના ચીર
એ તો મહાસભાનો વીર
બંધ આંખને કાન બધિર.

આ માણસ એટલે કોણા -
એ તો મહાભારતનો દ્રોષા -
અથત્યામાનો અવતાર
મરતો-જીવતો બબ્બે વાર
આ માસ એટલે પ્રશ્ન
એ તો સ્વયં - બન્યો છે કુષ્ણા....
કહે છે 'યદા યદા હી ધર્મસ્ય'
પણ... માંગી બેસો સર્વસ્વ -
આ માણસ એટલે જંખના...
એ તો હરતી-ફરતી વંચના
જુદા માણસે જુદા રંગ -
ને - જાત સાથેનો જંગા....
આ માણસ એટલે - 'હું'
ને જીવું ત્યાં લગી, 'હું' -

तुम्हीं से शुरू होकर
तुम्हीं पे खस्तम होती है
हर कविता - हर बात
हर लम्हा - हर रात
तुम ख्यालों से दूर जाओ
तो कुछ और भी हो पाये ।

मेरा सम्बन्ध
अपने आप से
दूटता जा रहा है
बिखर रहे हैं मेरे पल
जिन्हे संजोकर रखा है
मैंने
किसी खास मौके
खास समय के लिये
मेरे आसपास ही है
मेरी पहचान के माध्यम
मेरे मन की देहरी पर
दस्तक दे कर
लौय रहे हैं
बंद दरवाजे तक आकर
छूटता जा रहा है
मेरा हाथ
मेरे अपने ही हाथ से
क्या तुम रोक नहीं सकते मुझे
तुम्हारे लिये - कुछ पल ही सही ।

मैं अपने आप को ढूँढ़ रही हूँ
तुम्हे कहीं मिल जाऊँ
तो हाथ थामे ले आना
मुझे - मुझ तक !

मुझे पता है
कि यह तुम्हारी राहगुजर नहीं है
न कोई वादा है
न पैगाम
न उम्मीद की कोई किरन ही....
पर मुझे तुम्हारा इंतजार करनार है
क्या पता
शायद
एक बार भी
यहां से गुजर जाये
हवा ही
तुम्हें छुकर भी
मेरी सांस छूट डाये
आसान -सी.....

मौन से शुरू होकर
मौन ही पर खत्म होनेवाला
यहरिश्ता
अपनी सांसे खो रहा है
क्यों नहीं
चंद शब्दों से कुछ रंगभरे सांस
दे दे हम इसे - उथार ही सही ।

हम इतने करीब....इतने यास..
और फिर भी
एक-दूसरे को
देखा है हमने
ऐसे
जैसे मैं स्टेशन पर
आँस तुम
गुजरती ट्रेन के मुसाफिर ।

मेरी रगरग में
बहजी जा रही है
सर्पदंश की सी तीव्र
तुम्हारे लिये मेरी झांशनाएं
लेबरनम के पीले फूलों से छक्का
लाल पथरीला रास्ता
तुम्हारे झंतजार में
बिछा हुआ - सा,
थक सा..बुझा सा गया है।
शाम का रंग
मेरी उदासी से मिलता
सुर्मयी सा हो चला है
पलकों से गिरता
गर्म - खारा - सा पानी
तकिये को भिगोता रहता है...रातभर
क्यों नहीं चले आते तुम ?
मुझा तक.....मेरे लिये।

हम अनजान
अपरिचित
उपर की तरफ बढ़ती लिपट के
दो हमसफर...
....चुपचाप गुजरता वक्त
और बीच बीच में
चमकते बदलती बढ़ती
मंजिलों के नंबर
पता नहीं
कौन - कहाँ उतरेगा ?

मुस्कराहटों के पल
मिलने बिछड़ने के
कुछ अधुरे क्षण
गिले - शिकवों की
वह छोटी - छोटी लड़ाई
कुछ टूटी - कुछ बिखरी
कही - अनकही
अपेक्षाओं की वह ल...स्वी-सी लिस्ट
खयालों से भरी कुछ अकेली शामें
इंतजार से सारा हिसाब
हमारे रिश्ते का ?!

उठते पल से
सोते क्षण तक
समय से जुड़ी
कभी कभी बातें ऐसी हैं
जो कही नहीं जाती
अनुभव के कुछ ऐसे पल
जिन्हें शब्दों में कहा
मुश्किल ही नहीं - नामुमाकिन है
वही बातें - वही सारे पल
तुम्हारे लिए - सिर्फ